


Since 1925...

ज्ञाति प्रवाहनुं साप्ताहिक माध्यम

क.द.ओ. प्रकाश समीक्षा

C.D.O. PRAKASH SAMIKSHA

Visit us at www.prakashsamiksha.com
E-mail : kdoprakash@gmail.com



RNI रजि. भा.ए. वर्ष : १८ • अंक : ४८ • ता. ३० नवेम्बर थी ०६ डिसेम्बर २०१५ • वार्षिक लवाजम रु. ५० • Regn.No. MCE/53/2015-17

It is sure now that
KDO GLOBAL SUMMIT ON IT AND EMERGING BUSINESSES
will be Nationally - Internationally recognized event




EVENT PARTNER : SHRI BHAWANJI ARJAN KHIMJI (1st MP of Kutch)

Event Organisers

K.D.O. Jain Mahajan of

- Bangaluru (Host),
- Chennai,
- Hydrabad,
- Mumbai
- Shri KDO Jain Trust, Pune

Video presentation of the ideological objectives of our **Udaan Niti** as well as **The Summit**. Its message is hand holding, encouraging, motivating and mentoring.



INTERNATIONALLY RECOGNIZED PERSONALITIES

Chief guest :



Shri Nandan Nilekeni

Chairman of the
Unique Identification Authority of India



Shri Anand Sankeswar

MD of VRL Logistics Ltd.
Logic behind Logistics

Learned Speakers :




Shri Sudhir Sethi

CEO, IDG Ventures Ltd.
Indian Startup Ecosystem-what's next?



Shri Santosh Panda

CEO- EXLARA
My Story - A Startup Journey



Prof. Ms. Nandini Vaidyanathan

CMD CARMA,
Art of Start



Shri Rishi Visvanath


VP -Fashion Flipkart
Digital Marketing in Growing Business

It is sure now that
KDO GLOBAL SUMMIT ON IT AND EMERGING BUSINESSES
 will be Nationally - Internationally recognized event

Learned Speakers



Shri Paras Sharad Dharmshi
 Toronto, Canada
 Startup for Startups



Shri Kalpraj Dharmashi
 Equity Investment
 a Money Multiplier Avenue



Prof. Dr. Kiran Momaya
 IIT Mumbai - Magt. of Tech &
 Innovation for Competitiveness



Shri Kishore S. Kuruwa
 Kochi - Changing business style to
 suit the changing business world



Shri Bharat Khimji
 Hubballi
 "Business as a Product"



CA Shri Tarun R. Lodaya
 Nigeria
 Beyond Auditing



Premchand Mota
 Kolkata - Importance of research &
 analysis for success in business



Shri Lalit Shah
 Hyderabad, Director Microsoft -
 Current Trends in IT



Shri Amit Somani
 Ex. Chief, Make My Trip
 E- Commerce



Shri Satyam Bansal
 Director Growth, Flipkart
 Mobile Commerce - Only Way Forward



Shri Chenraj Jain
 CMD - Jain Institutes of Education
 Education : the power of Future



Shri Lalit Meiseri
 Mumbai - Food & Agricultural sectors
 as emerging businesses.



Smt. Tina Dharamshi
 Architect, Mumbai
 Paths less travelled



Shri Sanjay Dharamshi
 Pune
 Dream & Dare



Shri Deven L. Shah
 USA - How can YOU build &
 deliver the next 'Apple'



Shri Monik Dharamshi
 Hyderabad
 On a tour with Tourism



Shri Manikant Dhulla
 " Mitthi Maani Manikant Bhagi "
 Catering Industry.



Shri Kirit K. Shah
 Mumbai,
 Making KDO Community Digital

Shri Tilakchand K. Lodaya - Chennai
 Smart Community Niti – UDAAN, Renewable Energy - Solar

MASTERS OF CEREMONY : Smt. Rajul B. Patel, Mumbai,
 Shri Bhadresh Patel, Mumbai Smt. Mahima Mohit Dand, Hubballi

Professional Due Diligence Team for Startup Proposals:

Shri CA Rajiv Luthia, Mumbai
Shri Ravi Raichand Dharamshi, Mumbai
Shri Mulraj Kalyanji Chheda, Mumbai
Shri Akaash Devchand Dharamshi, Mumbai

Zhalak Dikhalao - Idea and Startup presentation by the Participants
Open House: Participants

આધતંત્રીઓ

“પ્રકાશ”

ડૉ. વેલ્લ પાશ્ચીર ગોસર

“સમીક્ષા”

સનત્ શાહ અને
ગોવિંદજી જીવરાજ લોડાયા
“પ્રકાશ સમીક્ષા”

સનત્ શાહ

: તંત્રી :

રાયચંદ આર. નાગડા
સહ તંત્રી :
ચંદ્રસેન મોમાયા
મો. 9324618606

સમિતિ સભ્યો

કિરીટ લક્ષ્મીચંદ લાપસીયા
રાયચંદ રતનશી નાગડા
શરદ કાંતિલાલ શાહ (નાગડા)
કેશરસિંહ આણંદજી ખોના
તિલકચંદ કુંવરજી લોડાયા
કિરીટ ખેતશી મુનવર
કાશ્મીરા વિરેન્દ્ર લુકીયા
હિરાચંદ દામજી દંડ
પંકજ પ્રતાપ શાહ
ચંદ્રસેન હીરાચંદ મોમાયા
શૈલેશ સનત્ શાહ
જયંત વિશનજી છેડા

અંક નં. 48/2015

: કાર્યાલય :

પોસ્ટ/કુરીઅર પત્રવ્યવહાર માટે સરનામું
C/o. Shri R. R. Nagda,
Advocate High Court
29/41, Tamarind Lane,
Behind Poornima Rest.,
Rajabhadur Comp,
Nr. Stock Exchange Bldg.
Fort, Mumbai - 400 001

સમય : બપોરે ૧ થી ૪ ફક્ત
શનિ./રવિ. અને જાહેર રજાના બંધ

ચાલુ અંક માટે મેટર
સ્વીકાર માત્ર બુધવાર સુધી

પ્રકાશ-સમીક્ષા હવે નેટ પર....

www.prakashsamiksha.com
E-mail : kdoprakash@gmail.com

નોંધ : આ પત્રમાં પ્રકાશિત થતા
લેખકોનો સ્વતંત્ર અભિપ્રાય/મંતવ્યો
સાથે તંત્રીમંડળ સહમત જ છે એમ
માનવું નહીં. તેમજ આરોગ્યને લગતા
લેખો કે કોઈ જાહેરાતોમાં કરવામાં
આવતા દાવાઓ/વિધાનો અંગે
પ્રકાશ-સમીક્ષા સમિતિની કોઈ
જવાબદારી નથી.

પ્રગતિ - તિલકચંદ લોડાયા - ચેરમ્

જનરલ ઈલેક્ટ્રીકનો નારો છે ‘પ્રગતિ અમારું સૌથી મહત્વનું ઉત્પાદન છે’. વધુ પડતું વિચારવાનું છોડીએ અને ‘અમે આમ જ કરતા આવ્યા છીએ એટલે તે કરવાની આજ રીત છે’ એવા આત્મવિશ્વાસ સાથે આગળ વધીએ.

સ્થગિતતા આણતી પરંપરાઓનો ભોગ ન બનીએ. બરફ પર કંઈ ઉગી ન શકે. જો આપણે સ્થગિતતા આણતી પરંપરાઓને આપણા મગજને જડસુ બનાવવા દેશું તો નવા વિચારો અંકુરિત નહીં થાય. પછાત ને પાછળ પાડનાર વિચારણા ત્યાગી અને આગેકૂચ કરાવનાર પ્રગતિશીલ વિચારણા અપનાવો. કોઈ પણ માનવ પ્રવૃત્તિ પછી તે ઉપગ્રહ બનાવવાની હોય કે બાળ ઉછેરની હોય પૂર્ણ રીતે ખામીરહિત થવું અસંભવ છે. આનો અર્થ છે સુધારણા માટે અનંત અવકાશ છે.

આ જગતમાં જે કંઈ થાય છે તે તેની આદર્શ રીતે નથી થતું. સફળતાને વરેલા લોકો આ જાણે છે. એટલે જ તો તેઓ પૂછતા નથી કે ‘શું હું વધારે સારી રીતે કરી શકું’? તેઓ જાણે છે કે તેઓ કરી શકે. એટલે તેઓ પોતાની જાતને આવી પ્રશ્ન પુછે છે, હું વધુ સારી રીતે કેમ કરી શકું ?

માનવ જ્યાં તેને જવું હોય તેનો થઈને રહે છે. પ્રગતિ વિશે વિચારો, પ્રગતિમાં ભરોસો રાખો અને પ્રગતિ માટે ઝડૂમો. તમે જે કાંઈ પણ કરતા હો તેમાં સુધારણા લાવવાનું વિચારો, વિશ્વાસ રાખો કે તેમ થઈ શકે. કોઈ વસ્તુ થઈ શકે એમ માનવું મગજને તે કરવાના રસ્તા શોધવા ગતિશીલ બનાવે છે. આજ રસ્તો છે અને તેથી શ્રેષ્ઠ રસ્તો છે.

જ્યારે તમે કોઈ વસ્તુને અશક્ય માનો તો મગજ એવી નિરર્થક વસ્તુ શાને કરવી તેમ વિચારતું થઈ જાય છે. પણ જ્યારે તમે કોઈ વાતમાં માનો છો અને ખરેખર માનો છો ત્યારે તમારું મગજ ચોક્કસ તે માટેનો રસ્તો શોધી આપે છે.

આપણામાંના ઘણા આપણે આ કેમ કરી શકીએ એવા નકારાત્મક વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પ્રયત્ન કરવાનું જ છોડી દે છે જ્યારે ખરી રીત એ છે કે આપણે કરી શકીએ તે બાબત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે.

જીવનની બધી બાબતો જેમાં વ્યવસાય, ઘર અને સામુદાયિક વિકાસ એ બધું આવી જાય તેનું સફળતા સૂત્ર છે ‘તમે જે કરો તે સારું કરો’ અને ‘જે કરો તે વધુને વધુ કરો’ (એટલે કે તેમ જે કરો તેની ગુણવત્તા વધારો)

તમારી જાતને સતત યાદ અપાવો - તમે માનો કે જે તમે છો તેનાથી તમે વધુ સારા છો અને એટલે તમે બધી વસ્તુઓ અત્યારે જે રીતે કરી રહ્યા છો. તેને તેનાથી સારી રીતે કરી શકો.

તમારી જાતને સતત એની પણ યાદ દેવાવો કે તમે કરી શકો એટલું નથી કરી રહ્યા, એટલે તમે અત્યારે જે બાબત કરી રહ્યા હો તે વધી બાબતો બધુ પ્રમાણમાં કરી શકો.

ક્ષમતા એ તમે અત્યારે જે કરી રહ્યા હો, તે સારી રીતે કરવાની શક્તિ છે.

આ પ્રકારની વિચારણાને આધારે કે.ડી.ઓ. ગ્લોબલ સમિટ ઓન ઇન્ફોરમેશન ટેકનોલોજી એન્ડ એમરજિંગ બિઝનેશ સફળતાની દિશામાં અગ્રસર થયું છે. શું આવું કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના વ્યક્તિગત અને સમસ્ત સમાજજીવન માટે ન થઈ શકે ?

PROGRESS

(By Tilakchand K.L., Fmr. Chief Commissioner of I.T.;
9940636646; ourbrotherhood@yahoo.co.in)

The DRIVING FORCE behind the IDEA of KDO GLOBAL SUMMIT OF IT and EMERGING BUSINESSES is the unique human quality ,which as a matter of fact, is behind all the development and progress of the Mankind.

General Electric has a slogan – “ Progress is our most important product.”

Stop thinking, “ This is the way we have always done it. So this is the way it has to be done.”

Don't suffer from tradition paralysis. Nothing grows on ice. If we let tradition freeze our minds, new ideas won't sprout. Stop backward, regressive thinking and start forward, progressive thinking. Absolute perfection in any human endeavour, from building satellites to rearing children, is unattainable. This means that there is endless scope for improvement. Nothing in this world is being done as well as it can be done. Successful people know this. That's why they don't ask, "Can I do better?" They know they can. So they ask question, "How can I do it better?"

Man belongs to where he wants to go. Think progress, believe in progress and strive for progress. Think improvement in everything you do. Believe it can be done. Believing something can

be done sets the mind in motion to find a way of doing it. There is a way. And, there is a better way. When you believe it is impossible, your mind goes to work to prove why it is so. But when you believe and really believe that something can be done, then your mind will find a way, if you allow it to. Many of us try to defeat our desires simply because we concentrate on why we can't, when the only thing worth concentrating on is why we can.

In almost everything in life, from profession to home to community development, the formula for success is – 'do what you do better' (improve the quality of your output) and 'do more of what you do' (increase the quantity of what you do).

Constantly remind yourself – you are better than you think you are: so you can do everything in a better way than how you are already doing it. Also constantly remind yourself – you are not doing as much as you can; so you can do more of everything than what you are already doing.

Capability is the ability to better what you are already doing. Capacity is about doing more of what you are already doing.

Progress = improvement in capability + increase in capacity. (T.T. Rengarajan)

I am sure this SUMMIT will revive or inculcate this spirit of FACING CHANGES and CAN DO attitude among KDOS for their growth and development in all spheres of life.

પ્રકાશ- સમીક્ષાના જાહેરાત દર			
પ્રકાર	સાઈઝ	કલર	બ્લેક/વ્હાઈટ
આખું પાનું	160 x 225 mm	9,000/-	5,000/-
અડધું પાનું	160 x 111 mm	5,000/-	2,700/-
પા પાનું	77 x 111 mm	3,000/-	1,500/-
૧/૮ પાનું	77 x 54 mm	-	800/-
૧/૧૬ પાનું	77 x 27 mm	-	450/-

ચેક C.D.O. PRAKASH SAMIKSHA SAMITI ના નામે લખવા

જાહેરાત/લવાજમ ભરવા અમારી બેંક અકાઉન્ટની વિગત નીચે મુજબની છે.

For NEFT Transfer

Type of Account : Saving
Account Number : 002001003686
Name of the Bank : Shri Arihant Co-op Bank Ltd.
IFSC Code : ICIC00ARIHT
MICR Code : 400800003

Name of the Account: C D O Prakash Samiksha Samiti
For Mobile App Transfer

Our MMID Code : 8359036
Our Cell Number : 9324618606

You must write separate letter giving payment reference number, amount and date of transfer.

For old subscribers- Just give your Subscription Number for New Subscribers - Give full address as per above guidelines

જાહેરાત / લવાજમ મોકલ્યા પછી બેન્કનો રેફરન્સ નંબર, રકમ તથા તારીખની વિગત અલગથી મોકલવી.

જુના ગ્રાહકોએ ફક્ત ગ્રાહક નંબર મોકલવો.

નવા ગ્રાહકોએ પૂરું સરનામું ઉપર મુજબની સુચના પ્રમાણે લખી મોકલવું.

For Cheque Payment


Draw your cheque in the name of "C D O Prakash Samiksha Samiti" and payable at par at Mumbai.

ચેકથી જાહેરાત/ લવાજમ ભરનારાઓને ચેક

C D O Prakash Samiksha Samiti નાં નામથી મોકલવું.

ચેક at par મુંબઈ હોવો જોઈએ.

સીધી અને સરળ ભાષામાં લખાયેલ ચૌલા કુરૂવાનું વિચાર પ્રેરક પુસ્તક “સુખી થવાના સરળ ઉપાયો”



જ્ઞાતિના પ્રતિભાવંત મહિલા લેખિકા ચૌલા કુરૂવાનું વિચાર પ્રેરક આઠમું પુસ્તક “સુખી થવાના સરળ ઉપાયો” તેમના અગાઉના પુસ્તકો સ્ત્રી અને મોર્નિંગ વોકની જેમ વાંચવા ઉપરાંત ભેટ આપવા લાયક છે. જથ્થાબંધ ખરીદીપર રૂ. ૧૦ ટકા રાહત આપવાની વ્યવસ્થા છે. કિંમત માત્ર રૂ. ૧૧૦/-
સંપર્ક : ચૌલા કુરૂવા - 099130 92120

॥ श्री अनंतनाथाय नमः ॥



श्री क.द.ओ. जैन ज्ञाति महाजन, मुंबई

आयोजित

७पमो समुह लग्नोत्सव २०१५

शुभ दिन : रविवार, ता. २०-१२-२०१५

समुह लग्न समारोहमां जोडाववा

समस्त क.द.ओ. जैन ज्ञातिजनोने हार्दिक निमंत्रण...

मंगलमय कार्यक्रम

मागसर सुट ९, शनिवार, ता. १९-१२-१५

सांजे ४.३० क्लाकेथी रासगरबा - दांडीयारास

मागसर सुट १०, रविवार, ता. २०-१२-१५

सवारे ११.०० क्लाके
सामैयु

बापोरे १२.३९ क्लाके
हस्तमेलाप

सवारे ११.३० क्लाके
लोचन समारंभ

: मंगलमय कार्यक्रम स्थल :

असे. वी. जोशी हाईस्कूल, छेडा रोड, सारस्वत कोलोनी, डोंबिवली (ईस्ट) - ४२१ २०१.

प्रभुतामां पगलां मांडनार नपयुगतो

शि. हेमंत	जयंति मण्जिवाल मोता	(डोंबिवली - रापर गढवारी)
शि. काजल	लक्ष्मीचंद्र केशवळ लोडाया	(डोंबिवली - आरीभाण्णा)
शि. हरेश	शरदचंद्र रतनशी लोडाया	(कांटीवली - मोटी भावडी)
शि. अर्यना	शिवपूजन पेबाड गुमा	(मलाड - गुरेरा)
शि. जय	नवीन भेतशी मोता	(डोंबिवली - कुवापधर)
शि. सीता	शिवाळ बाबु घोवप	(थाण्णा - मुरबाड)

: सि. कन्वीनर :

अरविंद लोडाया - ०९८६७० २५७७५

चिंमनलाल नागडा - ०९३२२ २३२३८

: सभ्यो :

श्री विपुल कान्तिवाल लोडाया
श्री मयुर मोतीवाल लोडाया
श्री हरेश भीमळ मोमाया

श्री चेतन हीराचंद्र नागडा
श्री कमलेश शिवळ शियाल
श्री दीपक लवानळ लोडाया

अ.सौ. हंसाबेन लहेरी लोडाया
अ.सौ. कल्पनाबेन दीपक धरमशी
अ.सौ. ज्ञानाबेन विजय छेडा



પ્રશ્નો આપણા/આપના : માર્ગદર્શન પૂજ્ય જયદર્શિતાશ્રીજીનું

પ્રકાશ સમીક્ષાના આમંત્રણથી પૂ.સા.શ્રી ડૉ. જયદર્શિતાશ્રીજી મ.સા.એ ધર્મ અંગે સાચી સમજ કેળવવા ઇચ્છતા શ્રાવક-શ્રાવિકાઓ માટે તેમના પ્રશ્નોના સરળ ઉત્તર આપવાનું સ્વિકાર્યું છે. જ્ઞાતિજનોને તેમના ધર્મ જ્ઞાનનો પુરો લાભ લેવા નમ્ર વિનંતી.

શ્રાવક-શ્રાવિકાઓને પોતાના પ્રશ્ન પ્રકાશ સમીક્ષાની ઓફિસને સરનામે કે E-mail ID : kdoprakash@gmail.com પર મોકલવા, જેના ઉત્તર તેની અગત્યતા પ્રમાણે અપાશે.

પ્રશ્ન - સાધુ-સાધ્વીજી ભગવંત તથા શ્રાવક-શ્રાવિકાના પ્રતિક્રમણ પહેલાથી સાથે હતા કે જુદા હતા ?



ઉત્તર - ગતાંકમાં આપણે સાધુ અને શ્રાવકના પ્રતિક્રમણ પહેલેથી જુદા હતા એ વાત જાણી તથા એના કારણો પણ જાણ્યા.

કાળ પ્રભાવે અથવા મોહના પ્રભાવે શ્રાવકો ધર્મ આરાધનામાં સુસ્ત અને પ્રમાણે બન્યા. પ્રતિક્રમણાદિના સૂત્રો શીખવામાં બેદરકાર બન્યા પછી પ્રતિક્રમણના સૂત્રો આવડતા ન હોવાથી પ્રતિક્રમણ જેવી અવશ્ય કરવા યોગ્ય આવશ્યક ક્રિયામાં આળસ-પ્રમાદ કરવા લાગ્યા. આવશ્યક કરનાર શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા દિવસે દિવસે ઘટવા લાગી. તેથી જો શ્રાવક-શ્રાવિકાઓને સાધુ-સાધ્વી પ્રતિક્રમણ કરાવે તો ફરી સંખ્યામાં વધારો થઈ શકે એવી વિચારણા કેટલાક આચાર્યોએ કરી. જો સાધુ-સાધ્વીજી ભગવંતોને શ્રાવકો કે શ્રાવિકાઓને પ્રતિક્રમણ સાથે કરાવવા હોય તો વિધિમાં ફેરફાર અનિવાર્ય બન્યો. સાધુ-સાધ્વીજી ભગવંતોના પ્રતિક્રમણમાં કેટલાક ફેરફાર સંભવિત ન હોવાથી શ્રાવક-શ્રાવિકાઓના પ્રતિક્રમણમાં કેટલાક કરાવીને એમને સથે જોડવામાં આવ્યા. વિ.સં. ૧૩૦૦ (આશરે ઇ.સ. ૧૨૪૪) પછી આ ફેરફાર થયેલ છે. ત્યાં સુધી બધા જ સંપ્રદાયોમાં સાધુ અને શ્રાવકના પ્રતિક્રમણ જુદા જ હતા.

આપણે આપણી ક્રિયા જાણવી... ઓળખવી અને શીખવી જોઈએ. આપણે કોઈના આધારે નહીં પરંતુ સ્વતંત્ર રીતે કરવી જોઈએ. સંઘમાં સમુહ પ્રતિક્રમણાદિમાં ઉજ્જેઈ આદિના દોષોને ટાળવા પ્રતિક્રમણ વિધિ શીખી લેવી. સ્વયં કરીને સંઘને નિર્દોષ પ્રતિક્રમણ કરાવવાથી જિનાજ્ઞા... શાસ્ત્રાજ્ઞાના પાલન સાથે મહાન પુણ્ય ઉપાર્જન થાય છે અને વિપુલ કર્મ નિર્જરાના ભાગી બનીએ છીએ. પ્રતિક્રમણના છ આવશ્યક શ્રાવક માટે અને સાધુ માટે જેમ ગુણદાર ભગવંતોએ જણાવ્યા છે તેમજ કરવાના છે. એમાં કોઈ ફેરફાર કરવાનો આપણને અધિકાર પણ નથી અને એમાં આપણું શ્રેય પણ નથી.

પ્રશ્ન - હાલમાં એક પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે કે પક્ષી વાંદણ છઠ્ઠા આવશ્યક પહેલા આપવા કે છઠ્ઠા આવશ્યક પછી આપવા? એમાં આપનું મંતવ્ય શું છે ?

ઉત્તર - છઠ્ઠા આવશ્યક પછી પક્ષી વાંદણની પરંપરા અચલગચ્છમાં ચાલતી આવી છે અને એમ જ હોવું ઘટે છે. આપણે મૂળ છ આવશ્યકની વિધિમાં કોઈ ફેરફાર કરવાના અધિકારી નથી. જે કાંઈ પણ વધારો-ઘટાડો કે ફેરફાર કરવા હોય તે છ આવશ્યક પછી જ સંભવી શકે છે. તેથી મૂળ પરંપરાને છોડવાનું યોગ્ય જણાતું નથી. અંતે તત્ત્વ કેવલી ગમ્ય છે. કોઈ પણ ચાલી આવતી પરંપરાને સબળ કારણ વિના છોડવી હિતાવહ નથી.

<p>યાત્રા પ્રવાસ ક્ષેત્રે આધુનિક પ્રણાલીકાઓના પ્રણેતા...</p>  <p>9323360708/25903514-5-6 tanmantravels@yahoo.co.in www.tanmantour&travel.com</p>	<p>શાંતિજિન જાગૃતિ ગ્રુપની રજત જયંતિ ઉજવણીના કાર્યક્રમો અને ખાસ કરીને કચ્છમાં સમસ્ત જૈન સમાજનો સમૂહ લગ્નોત્સવ સીમાચિહ્ન રૂપ સફળતા પામો.</p> <p>તન-મન પરિવાર</p>	<p>શીખરજીની સર્વ પ્રથમ અને એકમાત્ર આપણી પોતાની ★★★ જેવી સુવિધાયુક્ત AC હોટલ</p> 
--	---	--



રાજશ્રી યોગા અને ફેટ ફ્રી ઝોન છેલ્લા ૨૦ વર્ષથી શારિરીક તથા માનસિક તંદુરસ્તીના ક્ષેત્રે અપ્રતિમ...
૨૦-૨૦ વર્ષ સુધી એક્સરખા રીઝલ્ટ આપવા બહુ મુશ્કેલ છે. અમે એક સરખા નહીં પણ એક બીજાથી ચડીયાતા રીઝલ્ટ આપીએ છીએ. તે પણ બિમારીઓ, ઓપરેશન, સીઝરિયન, ડિલીવરીઓ કે ગમે તે તકલીફ હોય છે વજન ઉતાર્યા પછી એવું લાગે કે ક્યારેય બ્રાહ્મ નહતા. લગન પહેલાં હતો તેવો શેપ, સાર્થક અને વજન આવી જાય છે.

નાલાસોપારા, ડોંબીવલી, સફાળા હોય કે પાલઘર વજન ઉતારનારાઓ માટે રાજશ્રી યોગા અને ફેટ ફ્રી ઝોન ક્યારેય દૂર નથી.

“અજુ બેને નાલાસોપારાથી આવીને વજન ઉતાર્યું અને વજન ઉતાર્યા પછી એમને સમજાયું કે પોતાના માં કેટલી સ્ફૂર્તિ અને શક્તિ છે. સમય અને શક્તિ નો સદુપયોગ કરવા બ્યુટી પાર્લરનો કોર્સ કરી કામ કરવા માગે છે. તમને ભવિષ્યમાં તંદુરસ્ત રહો અને સફળતાઓ એ માટે અમારી શુભેચ્છાઓ.”

નામ નહીં કામ બોલે છે

અંજુ પરેશ ગાલા



પહેલાં

પછી

પહેલાં

પછી

ટોટલ વજન ઉતાર્યું - ૧૭ કીલો ★ ટોટલ ઈંચ ઉતાર્યા - ૧૧૫ ઈંચ

“મારું વજન વધતું જતું હતું, પીરીયડ ૩-૪ મહિના લેટ આવતું હતું. મેનોપોઝ જેવું હતું, વજન વધતું જતું હતું, ચાલવાથી હાંફ ચડતી. ગેસ બહુ થતો, શરીરમાં દુખાવા રહેતા, અચાનક વીકનેસ લાગતી અને પસીનો થઈ જતો. ઘણી દવા કરી પણ કંઈ ફરક પડતો નહતો. એવામાં પત્રિકામાં રાજશ્રી યોગા વિશે વાચ્યું અને અહીં આવ્યા પછી આશ્વાસન લાગ્યું અને કોર્સ ચાલુ કર્યો અને એનું પરિણામ ૪ મહિનામાંજ આવી ગયું. વજનની સાથે તકલીફો પણ ગઈ. નાલાસોપારા થી આવવાનું દૂર થતું હતું પણ વજન ઉતાર્યા પછી અને બિમારીઓ મટ્યા પછી હવે કાંઈ દૂર નથી લાગતું સ્ફૂર્તિ અને સ્પીડ આવી ગઈ છે. ફરી થી પીરીયડ પણ રેગ્યુલર થઈ ગયો છે. જેઓ વજન ઉતારવા ક્યાય નથી ગયા. એમના માટે આ સૌથી સારી જગ્યા છે.”

Ph:- 93233 33303, 93218 99909, 24104142

જાસ નોંધ : અમારા કોઈ આસીસ્ટન્ટ, અમારા દ્વારા તાલીમ લીધેલ કોઈ વ્યક્તિ કે ક્યાંય બ્રાન્ચ કે ફ્રેન્ચાઇઝી નથી. મેડીકલ કોન્સલ્ટેશનું માર્ગદર્શન ઉપલબ્ધ. એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી.

પ, ધન બીલીંગ, પહેલે માળે, દાદા સાહેબ ફાલકે રોડ,

ગાડગે મહારાજ સેનેટોરિયમની સામે ભરતક્ષેત્રની ગલી માં, દાદર (ઈ), મુંબઈ - ૪૦૦ ૦૧૪

વેબસાઇટ : www.rajshreeyoga.com E-mail : rajshreeyoga@gmail.com

ઘરમાં ભગવાન

પ્રશ્ન - અમારે ઘરમાં ભગવાન પધરાવવા હોય તો પધરાવી શકાય ?

ઉત્તર - ભગવાન લોકોત્તર પુરૂષ છે..... ત્રણ લોકના નાથ છે.... ઈન્દ્રાદિને પણ વંદનીય અને પૂજનીય છે. આવા દેવાધિદેવને ઘરમાં પધરાવવાના ભાવ થવા એ જ આપણા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને સુચવે છે. તમારી ભાવના અત્યંત સુંદર અને અનુમોદનીય છે. ભગવાનને અતિ આવશ્યક છે. પરમાત્મતત્વનું યોગ્ય બહુમાન જળવાય અને ક્યાંય એમની આશાતના ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

ભગવાન ઘરમાં પધરાવવા હોય તો પ્રથમ વિચારણા આવશ્યક છે કે આપણે દર્શનીય ભગવાન પધરાવવા છે કે પૂજનીય ભગવાન પધરાવવા છે.

દર્શનીય ભગવાન એટલે અઠાર અભુષણો કરીને પ્રભુ દર્શન અથવા વાસકોપ પૂજા માટેના આલંબનાર્યે ઘરમાં ખીરાજમાન કરવા. આ પ્રતિમાજીની પક્ષાલ એવં ચંદનાદિ પૂજા આદિ કરવાની નથી હોતી.


પૂજનીક ભગવાન એટલે આચાર્ય ભગવંત દ્વારા અંજનની વિધિ કરાયેલા ભગવાન. આ ભગવાન જિનાલય/દેરાસરના ભગવાનની જેમજ પૂજનીક હોય

છે. ભગવાનનો દરરોજ પક્ષાલ થવો જ જોઈએ તેમજ ચંદન પુષ્પાદિ પૂજા પણ આવશ્યક થવી જ જોઈએ. આ પૂજનીક ભગવાન માટે અલગ જ રૂમ પણ અપૂજ નજ રહેવા જોઈએ. પૂજનીક ભગવાન માટે અલગ જ રૂમ અથવા સ્થાન હોવું જોઈએ. એની વિધિપૂર્વક મહોત્સવ સહિત પ્રતિષ્ઠા કરવી જોઈએ. પ્રભુજીની પૂજાના વાસણ તથા અંગલુંછણા વગેરે દોષ ન લાગે તેમ ધોવાની વ્યવસ્થા પણ આવશ્યક હોય છે.

દર્શનીય પ્રતિમાજી ગોખલામાં પધરાવી શકાય પરંતુ તે પ્રતિમાજી શયનકક્ષ (Bed Room) કે ભોજકક્ષ (Kitchen)માં ન રાખી શકાય હોલ કે ગેલેરીમાં આશાતના ન થાય એવી રીતે પધરાવવા તેમજ પડદો રાખવો. દર્શનાદિ ક્રિયા વખતે ખોલવો અન્યથા બંધ જ રાખવો.

પૂજનીક કે દર્શનીય પ્રતિમાજી અગિયાર ઈંચ સુધીના જ રાખવા. સોનાના, ચાંદિના, પંચધાતુના, સ્ફટિકાદિ રત્ન કે આરસના પ્રતિમાજી રાખી શકાય છે.

પ્રભુ પ્રતિમા સહુથી ઉંચી હોય, એનાથી નીચા સ્થાને ગૌતમાદિ ગુરૂમુર્તિ હોય અને એનાથી નીચે દેવ-દેવીની પ્રતિમાજી હોય. એ રીતે ગોઠવણ કરી શકાય છે.



હૃદયાંજલિ

જૈનશાસનમાં વ્યાખિત શ્રાવક શબ્દ ને ક્ષણે ક્ષણ જીવનાર...

ધર્મ શ્રદ્ધાવાન, વ્યવહારે વિવેકવાન અને

કાર્યે કર્મયોગી એવા અમારા વડીલ

શ્રી ભવાનજીભાઈ નરશી ભોજરાજ છેડા

ની છાયા ઉઠી જતાં એમનાં કુટુંબીજનો સાથે અમે પણ

નોંધારાપણાની લાગણી અનુભવીએ છીએ.

પરમકૃપાળુ પરમાત્મા એમના પવિત્ર આત્માને

શાંતિ અર્પે એવી અભ્યર્થના...



લિ. કર્તુરીબાઈ દિરજી કાનજી પીર - નલિયાની સુપુત્રીઓ



લક્ષ્મીબેન ઝવેરચંદ બોરીયા - બાયેઠ (ભુજ)

મધુબેન લહેરચંદ ડાઘા - વરાડીયા (મુંબઈ)

હંસાબેન વિવેક મોમાયા - સાંચરા (ધુલિયા)

જયાબેન હીરજી પીર - નલિયા

श्री वाराणसी क.द.ओ. जैन मठजन्

श्री वाराणसी जैन युवक मंडल



कार्यालय : C/o. जल गम टूर्स एन्ड ट्रावेल्स, २०६, नेच्युन अपटॉन,
२२२ माणे, एन.एस. रोड, मुलुन्ड (पश्चिम), मुंबई-४०००८०.
फोन : ०२२ २५८३४५४५, २५६८३२३९, २६९२९०६२, २६९२२२७०

अजडासानी नूतन पंचतीर्थी 'वावालापरा' पैकी ना वाराणसी नगरे पर्युषण पर्य वि. सं. २०७९ श्रावण वद-१३, शुक्रवार, ता. १९.०८.२०१५ थी
भादरवा सुद-६, शनिवार, ता. १८.०८.२०१५ दरम्यान नवकारशी, मध्याह्न भोजन, मध्याह्न या, चौविहारना दाताश्री परिवारनी नामावली.

संपूर्ण दिवस

मातृश्री नवलभेन ढाकरशी लोडाया-गांधीधाम	मातृश्री धनभाष कल्याणु भेदा-मुलुन्ड
मातृश्री प्रेमीलाभेन सोमचंद नागडा-घाटकोपर	मातृश्री तेजभाष लालु लोडाया
शेठश्री रायचंद शीवलु छेडा-मुलुन्ड	हस्ते : अरविंदभाष, भूपेन्द्रभाष - गांधीधाम
मातृश्री कस्तुरीभाष केशवलु नागडा-डोंगिवली	शेठश्री टोकरशी रतनशी लोडाया-डोंगिवली
शेठश्री भवानलु अरवण भेदा-मुलुन्ड	शेठश्री अशोक कल्याणु भेदा-मुलुन्ड
मातृश्री प्रेमीलाभेन मेघलु मोता - मुलुन्ड	शेठश्री हंसराज विरलु वीकमशी-डोंगिवली

नवकारशी

मातृश्री दमचंतीभेन जेठालाल नागडा-मुलुन्ड	श्री हर्षद मुलचंद लोडाया-भांडुप
ना स्मरणार्थे हस्ते : भानु शैलेष नागडा	श्रीमती हंसाभेन भूपेन्द्र भेदा-माहुंगा
मातृश्री रतनभाष शीवलु मोमाया	श्री नवीनचंद्र यत्रभोज लोडाया-मस्तुदण्डर
हस्ते : विरेन्द्र मोमाया-डोंगिवली	श्री धनलु भीमलु लालका-भांडुप
श्री प्रेमचंद हंसराज लोडाया-डोंगिवली	श्री ज्योतेन्द्र रामलु लोडाया-डोंगिवली
मातृश्री रतनभेन लाललु नरशी लोडाया-डोंगिवली	मातृश्री चेतना ललीत लोडाया-घाटकोपर
मातृश्री नवलभेन आणंदलु लालका -संधवा	श्री भरत लाललु लोडाया
मातृश्री जयचंतीभेन भवानलु लोडाया-पाचोरा	हस्ते : मनन लोडाया

मध्याह्न भोजन

श्री महेंद्र मुरलु मोता-कल्याण	श्री राजेन्द्र पदमशी लालका-विकोली
मातृश्री प्रेमीलाभेन मेघलु मोता (तन-मन टूर्स) - मुलुन्ड	श्री गुलाबचंद भवानलु शाह (लोडाया) ह. : धश्वरभाष-वर्सोवा
अ.सौ. प्रभाभेन प्रविण लालका-मुलुन्ड	श्रीमती सरलाभेन लाललु लोडाया-डोंगिवली
श्री लक्ष्मीचंद रायचंद भेदा-मुलुन्ड	मातृश्री विमलाभेन शीवलु लोडाया
श्रीमती प्रेमीलाभेन जवेरचंद भेदा-मुलुन्ड	मातृश्री प्रेमाभाष भाणु लालका
मातृश्री सरलाभेन शांतिलाल लालका-चोपडा	ह. मातृश्री कस्तुरीभाष रायचंद लालका-भोरीवली
श्री शीतलकुमार लक्ष्मीचंद छेडा-मुलुन्ड	मातृश्री कस्तुरभाष जयराज लोडाया-अंधेरी
	श्री लहेरचंद नाराणलु लोडाया-भांडुप

चौविहार

मातृश्री जयचंतीभेन गुलाबचंद भवानलु शाह (लोडाया)-धुलीया	श्री यत्रभुज ठिकेडा छेडा-मुलुन्ड
श्री प्रेमलु देवराज लोडाया-मुलुन्ड	वि. मयंक हिलीप हंसराज मोता-घाटकोपर
मातृश्री पुष्पाभेन किशोर भेदा हस्ते : सुपुत्रो-थाण	मातृश्री धनलक्ष्मी हीराचंद लोडाया-डोंगिवली
मातृश्री घण्टुमती हीराचंद छेडा हस्ते : यतीशभाष-पुना	श्री रायचंद डुंगरशी गोसर-वाशी
वि. प्रतिक अमय छेडा-वापी	

मध्याह्न या

श्री भीमलु यत्रभोज लालका-आदिपुर (दरेक दिवस)	श्रीमती लताभेन हीराचंद छेडा-डोंगिवली
मातृश्री जेठीभाष गोविंदलु मोमाया-भांडुप	मातृश्री सोनभाष लक्ष्मीचंद लोडाया, (अपेक्षा डेरी) - चालीसगाम
श्री भरत पदमशी लालका-मुलुन्ड	श्री मुलचंद भाणु लोडाया-डोंगिवली
श्री भवानलु माणिकलु लोडाया-वाराणसी	श्री नवीनचंद्र जयराज लालका-मुलुन्ड चेकनाका
मातृश्री हीरभाष कुंवरलु लालका हस्ते : जयेश -डोंगिवली	श्री माणिकलु कुंवरलु शीयाल-वाराणसी ह. : लहेरचंदभाष
श्रीमती पुष्पाभेन महेंद्र भेदा-मुलुन्ड	श्री शांतिलाल रामलु लालका-हुणली
श्री दिनेश केशवलु लोडाया-डोंगिवली	अ.सौ. स्व. लीलावती कुसुमकांत लालका ह. : कुसुमकांत -डोंगिवली
मातृश्री मानभाष जवेरचंद लोडाया-गांधीधाम	मातृश्री वेलभाष टोकरशी लालका-घाटकोपर



पर्युषण पर्य दरम्यान श्री संघनी दरेक योजनाओ माटेना सर्वे दाताश्री परिवारजनोनी हृदयपूर्वक अनुमोदना.



કેળવણી અને આપણી જ્ઞાતિ - ૨

રમેશ મુલજી લોડાયા - ભરૂડિયા, મુલુંડ - 98203 36767

જ્ઞાતિમાં કેળવણીનો ફેલાવો કરવામાં માસ્તર લક્ષ્મીચંદ તેજપાર મૈશરીનાં અથાગ પ્રયાસો ફળ્યા અને થોડા શિક્ષિત યુવા જ્ઞાતિને મળ્યા પરંતુ તે જમાનાના રૂઢી ચુસ્ત સમાજનાં અધિકારીઓ સામે પોતાના સ્વતંત્ર વિચાર રાખવા ખુબ જ મુશ્કેલ કામ હતું.

રૂઢી ચુસ્ત શેઠીયાઓના મોગલાઈ દોર તથા જુલ્મોમાંથી જ્ઞાતિને સ્વતંત્ર બનાવવા નવો ઉદ્દામ મતવાદી (મહાજન) પક્ષ રચાયો. શેઠશ્રી નરશી કેશવજી નાયક શેઠીયા પક્ષ છોડી સામાન્ય જ્ઞાતિનાં પક્ષમાં જોડાયા. સને ૧૮૯૪માં શરૂ થયેલ આ ચળવળનો પ્રારંભ રાજગોર બ્રાહ્મણોને ફરજિયાત જમાડવાનાં જુલ્મ સામે થયો. જ્ઞાતિ બે પક્ષ શેઠીયા પક્ષ અને મહાજન પક્ષમાં વહેંચાઈ ગઈ. કોર્ટમાં કેસ લડાયો જેમાં મહાજન પક્ષને જવલંત વિજય મળ્યો. શેઠ શ્રી નરશી કેશવજી નાયક જ્ઞાતિ સુધારક બન્યા. જુના રીત રીવાજોમાં ઘણા ફેરફાર કર્યા. જ્ઞાતિ ઉત્થાનનો માર્ગ ખુલ્લો બન્યો. મહાજનની સત્તા પણ શેઠીયાઓના હાથમાંથી સરકી મહાજને નિમેલ સમિતિના હાથમાં આવી.

માસ્તર લક્ષ્મીચંદ તેજપારનું સને અવસાન ૧૯૯૮માં થયું. જ્ઞાતિમાં કેળવણીનો પ્રચાર સંગીન રીતે થાય તે માટે મજબૂત ખાતો (વિભાગ) સ્થાપવાની જરૂરત આગેવાનોને લાગી. મહાજન પક્ષના હાથમાં સમાજનો દોર આવ્યા બાદ આ ક્ષેત્રે આગળ વધવા એમણે ખૂબ જ પ્રયાસ કર્યો. પણ એમની હયાતી દરમ્યાન સફળતા મળી નથી. કેળવણીના મહત્વથી અજ્ઞાત શ્રીમંત વર્ગ આગળ આવ્યો નહિં.


આપણી જ્ઞાતિના નિડર પત્રકાર શ્રી ખીમજી હીરજી કાયાણી નોંધે છે કે જ્ઞાતિના ઉદય માટે વખતને અનુસરતી વ્યવહારિક સાથે ધાર્મિક કેળવણી આપનારા એક ખાતાની સંગીન પાયા ઉપર સ્થાપના થવાની આવશ્યકતા આખરે એક નર રત્નને જણાઈ. એ નર રત્ન એટલે સાંયરાના સપૂત શ્રી માણેક ચાંપસી ખોના.

માણેક ચાંપસી ખોના જ્ઞાતિના નાના અદના માનવી કોઈ મોટા શ્રીમંત નહીં. શાસ્ત્રમાં કહ્યું છે કે ૧૦૦માં એકાદ શૂરવીર મળે, હજારમાં એકાદ પંડિત મળે, દશ હજારમાં એકાદ વક્તા મળે પરંતુ લાખમાં

શ્રી આણંદ પરિવાર તરફથી પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલી

ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ,
અગણીત છે ઊપકાર એમના, એહ કદિ વિસરશો નહિં.

૨૮ મી પૂણ્યતિથી



પિતાશ્રી શામજી કેશવજી દંડ
દેહવિલય તા.૧૩-૧૨-૧૯૮૭

આઠમી પૂણ્યતિથી



માતુશ્રી વિજયાબેન શામજી દંડ
દેહવિલય તા.૦૩-૧૨-૨૦૦૭



જેમ ચંદન જાતે ઘસાઈને અન્યને સુગંધ બક્ષે તેમ આપ બાળપણથી અંત સુધી તનતોડ મહેનત કરી અમોને સુખનો સાગર સોંપતા ગયા. આપનો નિઃસ્વાર્થ સ્વભાવ, નીડરતા, પ્રમાણિકતા અને વ્યવહારિક કોઠાસુઝનો વારસો અમારા માટે હંમેશાં માર્ગદર્શક બની રહેશે. આપના અધુરા સ્વપ્નોને પૂર્ણ કરવા ઈશ્વર અમને શક્તિ આપે અને આપના પવિત્ર આત્માને શાશ્વત શાંતિ બક્ષે એવી પ્રાર્થના..

~ શ્રદ્ધાંજલિ સુમન ~

સમસ્ત આણંદ પરિવાર

નરેન્દ્ર, ચિમન, હરીશ, હિરેન, મધુકાંત તથા માણીબેન અને પુત્રવધુઓ-બાળકો તેમજ સમસ્ત પરિવાર

એકાદ દાતા મળે કે ના મળે. સંપત્તિ હોય તે જ દાતાર થઈ શકે એવું નથી. દિલની દાતારી અંદરથી આવે છે. હૈયામાં જ્ઞાતિદાઝ અને હિંમંત હોય તો નાનો અદનો માનવી પણ ઈતિહાસ સર્જી શકે છે એવું જવલંત ઉદાહરણ છે શેઠ શ્રી માણેક ચાંપસી ખોના.

માણેક શેઠ માનતા કે જ્ઞાતિનું ઉત્થાન કેળવણી સિવાય શક્ય નથી. બુદ્ધિને કેળવી તેને સન્માર્ગે ચઢાવાય તો ઉન્નતિ થયા વગર રહે નહિ અને આ કરવાનું માત્ર કેળવણી દ્વારા જ શક્ય છે. જ્ઞાતિનું પછાતપણું અંધેર વહીવટ, જુલ્મો, ત્રાસ વગેરે થવાનું કારણ કેળવણીનો અભાવ છે. કેળવણી વિપત્તિમાં ધૈર્ય આપે, સંપત્તિમાં સુખ આપે, દુઃખી દિલને શાંત કરે, પાપીને સદ્બુદ્ધિ સુઝાડે-એવો એમને વિશ્વાસ.

કુદરતે એમનો પુત્ર ખીમજી કુસંગનો શિકાર બની અવળો રસ્તે ગયો. ધર્મમય જિવન જીવનારા માણેક શેઠને આમાં પોતાનો જ દોષ જણાયો. એમને એ વાતનો વસવસો સદાય રહ્યા કરતો કે મેં મારા પુત્રને ઉચિત શિક્ષણ ન આપ્યું તેથી તે ખરાબ લતે ચડ્યો. ઉંડે ઉંડે આ દુઃખ એમને કોરી ખાતું. ભદ્રિક આત્મા હોઈ આ દુઃખ માટે મારે શું પ્રાયશ્ચિત કરવું તેનો વિચાર કરતા રહેતા. એમને થયું કે મારી જ્ઞાતિના સંતાનો યોગ્ય શિક્ષણને અભાવે કુરવાડે ચડયા છે તો જ્ઞાતિના બાળકો માટે સંસ્કારમય શિક્ષણ આપી શકે તેવી સંસ્થા સ્થાપી સાચું પ્રાયશ્ચિત કરવું. સદાય ધર્મને લઈ આગળ ચાલનારા હોઈ તેથી થયું કે વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પણ સાથે રહેવું જોઈએ અને તેમણે પોતાની તમામ સંપત્તિનો સદુપયોગ કેળવણીમાં કરવાનું નક્કી કર્યું.

તા.૨૯.૦૯.૧૯૦૦ની મહાજનની સભામાં માણેક શેઠે જાહેર કર્યું કે જ્ઞાતિના બાળકોના

વિદ્યાભ્યાસ અર્થે જો પાઠશાળા જેમાં વ્યવહારિક સાથે ધાર્મિક શિક્ષણ અપાય સ્થાપવામાં આવે તો પોતે તેવા ખાતામાં પોતાની મૂડી રૂ.૧૫૦૦૦ ની રકમ આપવા તૈયાર છે જેનો મહાજને સ્વીકાર કર્યો. સુથરીના શેઠશ્રી જેઠાભાઈ દામજીએ પોતાના સ્વર્ગવાસી કાકા શેઠશ્રી ભારમલ મેગજીના ટ્રસ્ટ ફંડમાંથી મજદુર ખાતામાં રૂ.૧૦૦૦૦ આપવાની જાહેરાત કરી. અન્ય જ્ઞાતિજનોએ પણ ફાળો લખાવ્યો અને ટુંક સમયમાં રૂ.૩૪૦૦૦ જેટલી રકમ થઈ ગઈ. એ વખતે જ્ઞાતિમાં એવા ઘણા શ્રેષ્ઠીઓ હતા જેઓ એકલે હાથે આટલી રકમ આપી શક્યા હોત. તેની સરખામણીએ સાધારણ સ્થિતિના માનવી માણેક શેઠનું રૂ.૧૫૦૦૦ નું યોગદાન કેટલું મહાન યોગદાન!!!

મહાજન વાડીની ઉત્તર દિશાએ રસોડા ઉપરના બંગલાનો ભાગ પાઠશાળા શરૂ કરવા મહાજને મફત આપવાની જાહેરાત કરી. જ્ઞાન પંચમી (કારતાક સુદ ૫) સવાંત ૧૯૫૭ તા ૨૮.૧૦.૧૯૦૦ ના મુંબઈના આગેવાન રાવ બહાદુર શેઠ શ્રી વસનજી ખીમજી જે.પી.ના પ્રમુખ પણા હેઠળનો જાહેર મેળાવડો યોજી પાઠશાળા ખુલ્લી મુકાઈ. અને જન્મ થયો... શ્રી કચ્છી દશા ઓસવાલ જૈન પાઠશાળાનો આ ઉદારદિલ માનવીએ ક્યાંય પોતાનું નામ રાખવાની પણ ન માંગણી રાખી. આ પ્રસંગે શેઠ માણેક ચાંપસીને જ્ઞાતિ તરફથી માનપત્ર અર્પણ કરવામાં આવ્યું.

શુભેચ્છક ભાઈ શ્રી માણેક ચાંપસી,

પ્રીય બન્ધુ,

અમો શ્રી કચ્છી દશા ઓસવાળ જૈન પાઠશાળા ખુલ્લી મેલવાના શુભ પ્રસંગે અત્રે એકઠા મળેલા ભાઈઓ આ ખાતાના મુળ સ્થાપક તરીકે આપને ક્યા શબ્દોમાં ધન્યવાદ આપીએ તે સમજી શકતા નથી.

દિવાળી ઘમાડા

આશુમોલ તક ફરી નહીં મળે

ટ્રેડીંગમાં માસીક ૪% ૩૬ મહીના આપના બેંક A/c માં, ૧૦૦% પેમેન્ટ **

૩૭માં મહીને મુદ્દલ રીફંડ,
વધારે વિગત માટે રૂબરૂ મળો.

Whatsapp :

096999 37370 / 093244 37370

જ્યોતિ

સિલ્ક સાડી એમ્પોરીયમ
Sachi Jari maate real nam

જરી ભરતકામવાળી સાડી, ચણીયા ચોળી, હુંડ તથા મશીનવર્ક સાડીઓ, બાંધણી - ઘરચોળા કસબ, કટવર્ક, જરદોશી વર્કની બોર્ડરો તથા બ્લાઉઝ.

જ્યોતિ હવે માટુંગામાં જ !

૨૮, ગની મેન્શન, અરોરા થિયેટર પાછળ,
માટુંગા (સે.રે.), કિંગ્સ સર્કલ, મુંબઈ-૪૦૦ ૦૧૯.
Tel.: 2404 3995 / 93222 58574

સુભાગ્યે આપણી જ્ઞાતિ વ્યાપાર ઉદ્યોગ અને દ્રવ્યાદિમાં આગળ પડતી છે, છતાં અત્યાર સુધી તમારા જેવા સુવિચાર થોડાના જ મનમાં આવેલો છે.

દાનોમાં વિદ્યાદાન સમાન એકે દાન નથી. તેમાં પણ સદ્વિદ્યા સાથે ધાર્મિક જ્ઞાન દાને ઈહલૌકીક પારલૌકીક શ્રેય સંપાદન થઈ મનુષ્યવતારનું સાર્થક થાય એવું દાન એ દાન કરનારને યાવત અક્ષય સુખદા છે એમ શાસ્ત્રો જ કહે છે તો પછી અમારે કહેવા જેવું શું રહ્યું ?

સ્વજ્ઞાતિ બંધુઓ અને સહધર્મી ભાઈઓને સંસારના ક્ષુદ્ર અને નાશવંત પદાર્થો પ્રત્યે વિતરાગી કરી શ્રેય સાધનોમાં સર્વજ્ઞ પ્રણિત વચનામૃત બોધે શ્રદ્ધાયુક્ત કરવાના, તમારા કર્તવ્યની જેટલી પ્રશંસા કરીએ તેટલી થોડી જ છે. આપણાં શ્રીમંત અગ્રેસરો અને અન્યબંધુઓ લક્ષ્મીનો સદુપયોગ કરવા, આ ખાતાને ઉદાર આશ્રય આપવા આપનું અનુકરણ કરે એમ ઈચ્છીએ છીએ.

સમાપ્તિમાં યાવત ચંદ્રદિવાકરો ચીર સ્થાયી કરનાર આ સુકીર્તી રૂપી પુષ્પ પરીમલ લેતા સર્વ બંધુઓને જોવા આપ દીર્ઘાયુષિ થાઓ અને આવા વિશેષ સુકૃત્યો કરી અમને પુનઃ પુનઃ ધન્યવાદ આપવા શક્તિવાન કરો, આવી તમારી શુધ્ધ અંતઃકરણની શ્રી દેવાધિદેવ પ્રત્યે પ્રાર્થના છે. તથાસ્તુ.

મુંબઈ કચ્છી દશા ઓસવાલ મહાજનવાડી રવીવાર તા. ૨૮.૧૦.૧૯૦૦

-વસનજી ખીમજી સભાના પ્રમુખ

પાઠશાળાના ટ્રસ્ટી બન્યા શેઠ માણેક ચાંપસી, શેઠ જેઠાભાઈ દામજી તથા શેઠ મેગજી ખેતસી અન્ય. જ્ઞાતિનાં જૈન બાળકોને લાભ. ઈ.સ.૧૯૦૫માં મહાજનવાડીની પશ્ચિમબાજુ મોટું મકાન થતાં બીજે માળે પાઠશાળા ખસેડાઈ. આ સંસ્થામાં ભણનારા બાળકોની સંખ્યા ૧૨૫ ની થઈ ગઈ. ૪ શિક્ષકોની નિયુક્તી થઈ. ધાર્મિક શિક્ષણ સાથે અંગ્રેજી ૫ ધોરણ સુધીનું ભણતર શરૂ થયું.

જ્ઞાતિના અનેક બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરી જીંદગીમાં આગળ આવ્યા અને જ્ઞાતિ ઉત્થાનમાં યોગદાન આપ્યું... આપી રહ્યા છે.

જેઠાભાઈ દામજીએ કાકાની સ્મૃતિમાં રૂ. ૧૦૦૦ લાયબ્રેરીમાં આપ્યા. મેટ્રીક સુધી આગળ લઈ જનાર તેઓ હતાં.

સને ૧૯૫૩માં ગં.સ્વ. લક્ષ્મીબાઈ ચત્રભોજ ખીંચસી અને ગં.સ્વ. વેજબાઈ ખેતસી ચત્રભોજ તરફથી મુંબઈ પાઠશાળાને રૂ. એક લાખનું દાન મળ્યું.

સને ૧૯૪૬માં પાઠશાળા સળગાવી દેવાઈ. હુલ્લડના કારણે કામચલાઉ ધોરણે પાઠશાળા અનંતનાથ દેરાસર ઉપાશ્રયમાં ખસેડાઈ. ૨૫ વરસ બાદ સને ૧૯૭૧માં ફરી મહાજનવાડીમાં ખસેડાઈ. આ સંસ્થાને મજબૂત બનાવવામાં અનેક વિરલાઓનું સંચાલનમાં યોગદાન રહેલું છે. તે પૈકી દલતુંગીના શ્રી લક્ષ્મીચંદ વીરજી લાપસીયાને અવશ્ય યાદ કરવા પડે.

૧૯૪૨માં આ શાળાના શિક્ષણને પાઠશાળાના નામ સાથે શેઠ ખેતસી ચત્રભોજ ખીંચસી અજાણી નામ જોડાયું મુંબઈની આપણી પાઠશાળા સમસ્ત જૈન સમાજમાં ભારતવર્ષની કેળવણી અંગેની પ્રથમ સંસ્થા છે.

માણેક શેઠનાં આ ઉમદા કાર્યનું મહત્વ ત્યારે વધી જાય છે જ્યારે એ વખતે હિન્દસ્તાનનાં કોઈપણ જૈન સમુદાય તરફથી આખું કેળવણીનું સંગીન ખાતું સ્થાપાયું ન હતું ત્યારે આપણી જ્ઞાતિમાં તેની સ્થાપના થયેલ છે. અખીલ ભારત શ્વેતાંબર કોન્ફરન્સ જ્યારે કેળવણી માટે સ્કુલો સ્થાપવાની અગત્યતા જોઈ આવા ખાતા શરૂ કરવાની સમગ્ર જૈન સમાજને ભલામણ કરતી હતી ત્યારે આપણાં સાંચરાના આ સપુત્રે જ્ઞાતિને ચરણે આવું ખાતું ધરી પણ દીધેલ. સામાન્ય શિક્ષણ મેળવેલ અને સાધારણ સ્થિતિના મુઠ્ઠી ઉંચેરા આ માનવીનું યોગદાન સદાય આપણને પ્રેરણારૂપે રહેશે.

શુભેચ્છા સહ.....

શ્રી હીરાલાલ હંસરાજ ડાઘા (માટુંગા-વરાડીયા)

અંગા શીપીંગ એજન્સીઝ

૪૦૧, રાજગોર ચેમ્બર્સ,
૯૯ મસ્જીદ સાઈડીંગ રોડ, મુંબઈ-૯.

શુભેચ્છાઓસહ *Laxmichand Dharshi Mota*

 **MOTA SHIPPING AGENCY**
C.H.A.No. 11-0404

રાજ લક્ષ્મી આરોગ્ય ધામ - પંચગીની
સંપર્ક : 08879677709

સંસ્કાર સિંચનું કામ પરિવારનું

નીના મારી અંગત મિત્ર છે. તેમ છતાં ખૂબી છે કે અમારી વાતોમાં અંગત ઓછું હોય અને વિશ્વસંગત વધુ. ટોળટપ્પાર કે પારકી પંચાત નથી કરતાં એવું નહીં. ગોસિપમાં કોને રસ નથી હોતો જો સાચું પૂછીએ તો ? ગોસિપ સ્ત્રીઓ માટે અળગા કરાયેલાં પાનાં પર ભાગ્યે જ આવે છે. એ આવે છે મસમોટાં અંગ્રજી, હિન્દી કે પ્રાદેશિક છાપામાં માટાં મથાળાં સાથે કે નાની મોટી આઈટમોમાં.

જો કે, નીનાને એટલા બધા વિષયોમાં રસ કે એના ક્ષેત્રની કે બીજી ગમે તો વાતો કરવામાં મજા પડી જાય. એક દિવસ નીનાએ અચાનક એક અંગત વાત કાઢી. કહે કે “એક વેકેશનમાં એ સાસરે અમદાવાદ હતી. આપણે ત્યાં સામાન્ય રીતે થતું હતું એવી જ રીતે ટોપલામાંથી પાકેલી કેરીઓ કાઢીને ચીરીઓ થાય અને સૌને વહેંચાય. એક સાંજે આ રીતે ચીરીઓ થઈ. નીનાએ પોતાના ભાગમાંથી કાઢીને અમુક દીકરાની પ્લેટમાં મૂકી દીધી. સાસુએ એને ટોકી. ‘કેમ? તને કેરી હવે નથી ભાવતી?’ ‘ભાવે છે ને! કેરી કોને ન ભાવે પણ આને પણ ભાવે છે ને!’ સાસુએ કહ્યું કે મારો પૌત્ર મને પણ વહાલો જ છે પણ તું એને શું કામ બગાડે છે ? નીનાને થયું કે ચાર ચીરી વધારે ખાય એમાં છોકરો કાંઈ બગડી જાય ? એની સાસુ કહે, ‘વધારે કેરી ખાવાનો સવાલ નથી. સાથે સાથે તું એને એ પણ શીખવે છે કે કોઈ વસ્તુ એને ગમતી હોય તો બીજા અને ખાસ કરીને પોતાની માતા, પોતાનો હિસ્સો જવા દે તો એ બરાબર છે.’ સાસુની ઈચ્છા હતી કે બાળપણથી જ સંતાનોને કેળવણી મળે કે સૌએ બંધુ વહેંચીને લેવું જોઈએ અને માતાને પણ ભાવતી વસ્તુ સરખી મળવી જોઈએ એ બાળક સમજે. સાસુમા સ્વાર્થી નહોતા. જીવનમૂલ્યો બાળપણથી જ સ્વાનુભવે કેળવાય એવું વ્યવહારિક રીતે માનતા હતા.

કદાચ એ યોગાનુયોગ છે એની સાસુનાં એક સિવાયનાં બધાં સંતાનો બહુ લાયક નીકળ્યાં. માનવવિકાસમાં ધરનાં અને બહારના ઘણાં તત્ત્વો કામ કરે છે અને ક્યાં ને કેટલાં આવાં તત્ત્વોની કેવી મેળવણી થશે અને શું પરિણામ લાવશે તેનું ભવિષ્ય ભાળવું મુશ્કેલ છે. તે છતાં એટલું નિશ્ચિત છે કે સંસ્કાર કામ તો કરે છે, અનેક રીતે. કેટલાંક વર્ષ અગાઉ નોંધવાનું બનેલું કે દક્ષિણ મુંબઈમાં ભપકાદાર વિસ્તારમાં રહેતા એક સંસ્કારી

દંપતીનાં બંને પુત્રો નાનપણમાં એવું સમજતા કે ગેટ પુસ્તકો લેવાજ જોઈએ. વેની સામેની તાજ મહાલ હોટેલ એક બુકશોપ છે. રાતે જમીને ડ્રાઈવ પર નીકળે ત્યારે બીજી કઈ બુકશોપ ખુલ્લી હોય. માબાપ બંને તાજની નાલંદા બુકશોપમાં જાય, પુસ્તકો જુએ, કાંઈક ગમતું હોય તે ખરીદે અને છોકરાંઓને પણ પસંદ કરવા પ્રોત્સાહન આપે. બંને પુત્રો તેજસ્વી બન્યા, ઘણું ભણ્યા, પોતાના ધંધા વિકસાવ્યા અને કેટલીક સદીઓ જૂની પરંપરાને નકામી લાગતા ફગાવી દેવાની હિંમત કરી શક્યા.



વનિતા
વિશ્વ

જો કે, વાત માત્ર સંસ્કાર સિંચનની નથી. સંસ્કાર આપવાનું કામ માત્ર માતાનું પણ નથી. આખા પરિવારનું છે. વડીલોનું વર્તન પણ એમાં મોટો ભાગ ભજવે છે.

સો વાતની વાત એ છે કે એ સૌમાં શું માત્ર માતાએ ત્યાગ કરવો એ ભાવના પોષાવી જોઈએ ? બાળક જન્મે અને થોડું મોટું થાય ત્યાં સુધી માતા માટે આ સહજ આવેગ છે, કુદરતી તત્ત્વ છે. ત્યાર પછી જે આવે છે તે માત્ર નૈસર્ગિક નહીં પણ સામાજિક છે. આજે કેટકેટલા પ્રકારની માતાઓ જોવા મળે છે ! આ લખાય છે ત્યાં વધુ એક વાર સમાચાર આવ્યા છે કે એક કુંવારી માતાએ નવજાત શિશુને સંડાસમાં નાખી સંકળ ખેંચી લીધી. શીના બોરાનો કિસ્સો તો ચગેલો છે જ કે માતાએ દીકરીનું ગળું દબાવી દીધું એવા પુરાવા આવી રહ્યા છે. મોટા લોકોની, ગ્લેમરસ લોકોની સનસનાટી ભરેલી વાત છે પણ કેટલીયે માતાઓએ ‘ઓનર કિલીંગ’માં કુટુંબની આબરુને નામે કે ધર્મ કે નાતજાતના વાડાબંધીને કારણે પુત્રીહત્યામાં હિસ્સો લીધેલો છે. એમાં શીખ ધર્મની નેતા સ્ત્રી હરિયાણાની ‘બાપ’ હેઠળ રહેતી હિંદુ સ્ત્રી કે પાકિસ્તાનમાં દીકરીને મળવાને બહાને બોલાવી હત્યા કરાવતી મુસ્લિમ માતા પણ આવી જાય છે.

જો માત્ર માતૃત્વ જ અઢળક પ્રેમ અને ત્યાગની ભાવના દૃઢ કરતું હોય તો આવી માતાઓ પાકતી ન હોત. માતૃત્વના એકવિધ વિચારોનાં દબાણમાંથી નીકળીને માતાને પણ જીવન માણવાનો અને પોતાની આ ઈચ્છા કે આવશ્યકતા પરિવારની સંસ્કાર સમજમાં આવી જાય તે હવે નીડ ઓફ ધ અવર છે, વર્તમાન કાળની જરૂરિયાત છે.

- સોનલ શુક્લ, લાડકી (મુંબઈ સમાચાર)માંથી સાભાર

ચાલો જહેમતે જાળવીએ આગવું દશાઈ કૌવત, આગવું દશાઈ ગૌરવ

ઉત્તમભાઈ કલ્યાણજી ખોના (શાહ) • કૌશલ ઉત્તમભાઈ ખોના (શાહ)

મો. 098225 30391

મો. 088057 55551

યુ. કે. ખીમજી એન્ડ કું. હળદર - જનરલ વ્યાપારી

વસંત માર્કેટ યાર્ડ, સાંગલી, મહારાષ્ટ્ર.

લગ્નસરાની સાડીઓમાં કેડીઓ જ્ઞાતિનું વિશ્વસનીય નામ

અવસર સારીમ

* સાચી/ટેસ્ટેડ કસબ અને જુક કસબ સાડીઓ, ચણીયા ચોલી.

* રીચલ/ટેસ્ટેડ ઘરચોળા, બોર્ડરો, પાનેતર, બાંધણીઓ તથા ફેન્સીવર્ક સાડીઓ

૧ રૂપલ અપાર્ટમેંટ, દાદાસાહેબ ફાળકે રોડ, સાધના હોટલની સામે, દાદર (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૧૪. ફોન : 022-24164239

સંપર્ક : દિનેશ દેઢિયા - 92234 25676

યોગનો અર્થ વર્તમાનમાં જીવવું ન ચિંતા હોય ન વ્યથા હોય. વર્તમાનમાં જીવવું એ જીવનને ઉત્સવ બનાવી દે. પ્રાણાયામ અને ધ્યાનનો અર્થ છે. આપણા ચેતનાકેન્દ્ર અને અસ્તિત્વથી જોડાવું. આપણી અંદર બધી અલૌકિક શક્તિ છે. એને જાગૃત કરવી પડે. યોગ એ કસરતની જેમ ફક્ત શારીરિક વ્યાયામ નથી, સંપૂર્ણ જીવનશૈલી છે. પ્રચલિત યોગાભ્યાસ આસાન અને પ્રાણાયામ સુધી જ સિમિત થઈ ગયું છે. યમ, નિયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના અભાવમાં નર થી નારાયણ અને આત્માને પરમાત્મા બનાવનાર યોગ સાધના માત્ર શરીરનો વ્યાયામ બની રહી ગયો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના અભાવમાં નર થી નારાયણ અને આત્માને પરમાત્મા બનાવનાર યોગ સાધના માત્ર શરીરનો વ્યાયામ બની રહી ગયો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ અષ્ટાંગ યોગ છે. યોગથી શક્તિ, સજાગતા, એકાગ્રતા મળે, નવજીવનની શરૂઆત થાય. અનિદ્રા, તાણ, ટેન્શનથી મુક્ત થવાય. આસન અને પ્રાણાયામથી રોગોથી બચાય.

પતંજલિ એ આસનને સુખમ્ સ્થિરમ્ આસનમ્ તરીકે વર્ણન કર્યું છે. એટલે એ સ્થિતિ આસન જેમાં આપણે આરામદાયક અને સ્થિર રહીએ. વધુ અને સારી રીતે જીવવા માટે સ્થિર થવું. ધીમા પડવું બહુ જ જરૂરી છે. આધુનિક વિજ્ઞાન પણ ફીટ રહેવાના મંત્રમાં શરીરની વધતી ચયાપચયાની ક્રિયાને લીધે શરીરના કોષોના વિચર એન્ડ ટિયર (ઘસારા) ઉપર ભાર મૂકે છે. આસન આ ચયાપચયાની ક્રિયાને ધીમી પાડી કોષોના વિચર એન્ડ ટિયરને ઘટાડે છે અને શરીરની તાકાત અને જીવનશક્તિ વધારે છે. શ્વાસ એ આસનનું મહત્વનું ભાગ છે. અને આસન કરીએ ત્યારે શ્વાસ પર નિયંત્રણ કરવાનું હોય છે. આજકાલની મોર્ડન મશીનો, સધનોથી કરવામાં આવતી કસરતોમાં કસરત થનાર યોગ આસનથી વિરુદ્ધ કોઈનુચ અનુકરણ કરે છે અને પોતાનાથી દૂર થઈ જાય છે.

આસન સ્થિરતા આપે અને મનનું ચંચળાપણું દૂર કરે. શરીરની ક્ષમતા વધારે છે. આસન ફક્ત શારીરિક કસરત નથી પણ મન, મગજને સજાગ કરે છે આણે શરીરને આત્મા, પરમાત્મા સાથે જોડે છે. યોગથી આરોગ્ય જળવાય છે અને માનસિક તાણ ઘટે છે. યોગથી હાઈ બી.પી. ઘટે છે, હાર્ટ-કેલ્યોરમાં સુધારો થાય છે, હૃદય અને તેની નસોની બિમારીઓનું જોખમ ઘટે છે. યોગથી વજન ઘટે છે. અમુક ચોક્કસ આસનો

પગના, પેટના અને ખભાના મોટા સ્નાયુના સમુહને મજબૂત બનાવે છે. યોગથી કેન્સરના પેશન્ટને ડીપ્રેશન, અનિદ્રા, દુઃખાવો, થાક અને ચિંતામાં ઘટાડો થાય છે. કરોડરજ્જુને થયેલ ઈજા યોગને પધ્ધતિસર કરવાથી મટી શકે છે. બે મહિનાના યોગથી ગરદનનો જુનો દુઃખાવો મટે છે. ફાઈબ્રોમાએલજીઆ ના પેશન્ટના દુઃખાવામાં પણ રાહત થાય છે.

યોગથી સાંધા અને લીગામેન્ટ્સ (સાંધાને પકડી રાખનાર કોષ સમુહ) નું ઓઈલીંગ સાડું રહે છે. યોગ શરૂ કરનાર વ્યક્તિએ યોગના યોગ્ય શિક્ષક પાસેથી શીખીને ધીરે ધીરે ઝડપ અને સમયગાળો વધારતાં જવું. યોગ્ય શિક્ષક પોષ્ટિક અને કુદરતી આહાર એની સાથે લેતા અને રોજીંદી આરોગ્યદાયી ક્રિયાઓ કરવાથી પૂર્ણ ફાયદા થાય. યોગ કોઈપણ ઉંમરે કરી શકાય અને યોગના રોજીંદા અભ્યાસથી ધીરજ, શિસ્તબધ્ધતા અને જાગૃતિ આવે છે. મન આધ્યાત્મિક ઉંચાઈ સર કરે છે અને ખરેખરા આનંદની અનુભૂતિ થાય છે.

આજના સ્ટ્રેશકૂલ લાઈફસ્ટાઈલવાળા યુગમાં તનાવ ઘટાડવું બહુ જ જરૂરી છે. શ્વાસ-ઉચ્ચશ્વાસની કસરતો, યોગ, ધ્યાન અને કોઈપણ પરિસ્થિતિમાં એકદમ પ્રતિક્રિયા કરવાને બદલે ૧ થી ૧૦ સુધી ગણતરી કરવાથી મન શાંત થાય છે અને તાણ ઘટે છે. સ્ટ્રેસને લીધે હૃદયની ઝડપથી ચાલે છે. બી.પી. વધે છે. અભ્યાસમાં જણાયું છે કે યોગ ધ્યાનથી હાઈ બી.પી. ઘટે છે, હૃદયની ઘડકન પર નિયંત્રણ આવે છે. તાણને લીધે વધુ ખવાય છે. અને વજન વધે છે. યોગ-ધ્યાનથી મગજ પરની તાણ ઘટે છે અને એ રીતે વજન પર નિયંત્રણ આવે છે.

અમેરિકાની યુનિવર્સિટી ઈલિનોઈસના રિસર્ચ કરનાર નેહા ગોથ અને એના સહયોગીઓએ ત્રીસ યુવાન વિદ્યાર્થીનીઓને હઠ યોગ કરાવીને મગજની વિચારવાની ઝડપ અને ચોક્કસાઈમાં શું ફરક પડે છે તે નોધ્યું હતું. તેનાથી જણાયું કે ૨૦ મિનિટના યોગ પછી તરત જ મગજની કાર્યક્ષમતામાં ખાસ્સો વધારો થયો હતો. એકાગ્રતા, નવી માહિતી યાદ રાખવાની ક્ષમતા અને જુની બાબત યાદ કરવાની ચપળતામાં નોંધનીય ફરક જોવા મળ્યો. આમાં ઊભા રહી, બેસી, સૂઈને કરવાના આસનો નો સમાવેશ થયો હતો. એટલું જ નહિ એ સમયગાળા દરમ્યાન વિવિધ સ્નાયુ સમુહનું સંકોચન અને વિસ્તરણ કરીને શ્વાસોચ્છવાસની પ્રક્રિયાનું નિયમન કરવામાં આવ્યું. ઊંડા શ્વાસ અને

જ્ઞાતિ નિધી દ્વારા નિયામક શુભ ઊર્જા સંચય કરીએ

જ્ઞાતિના ૨૫ વર્ષ પુરા કરે એવા ભાઈબહેન દરરોજ જ્ઞાતિ નિધીમાં ચાર આના (પાવલી)નું યોગદાન આપે તે ૬૫ વર્ષ પુરા થાય ત્યાં સુધી દુનિયામાં જ્યાં પણ K.D.O. આ ઉમરવાળા વસતી હોય તે ફરજ બજાવે. ૪૦ વર્ષ માટે જ્ઞાતિ નિધીમાં સહકાર આપવો ગરીબ પૈસાવાળો એવા ભેદ વગર ગામડામાં રહેતા કે ન્યુયોર્ક મેનહટનમાં રહેતો હોય. આ નિધીનો કોઈ કારભારી-સંચાલકના હાથે માત્ર નિધિ અરિહંત બેંકમાં જમા થતી રહે-બેંક જ સંભાળે, વ્યાજ જમા કરે ઉમેરે ના કોઈને આપવાના ના કોઈના વધુ લેવાના.


આ શું કામ કરશે ? આ એક ઉર્જા તરીકે રહેશે- નિયામક દ્રવ્ય તરીકે રહેશે- બેંકમાં જમા થતી રહે દરરોજનાં લેખે. આ હાલે નિયામક તત્વ રૂપિયા છે ૩૬૬ ની જેમ સેટલ ગર્વમેન્ટની જેમ જ્ઞાતિમાં એક અજબનો ઉત્સાહ આપશે-બધાંના કોમનપણું અનુભવશે કાંઈ લેવા દેવા નહિ ૨૫/૫૦ વર્ષ એની અરૂપી અનુભૂતિ આપણા જીવનમાં જેમ શ્વાસોશ્વાસ ચાલે છે. જન્મ મરણ ચાલે તેમ અદ્વશ્ય અરૂપી હાથ હશે. આ સતત અવિસ્ત જીવંતી રહેતી

નિધી તેનો પ્રભાવ બનાવશે-બધા કાર્યો આ રીતથી આ નિધીની હાજરી માત્રથી યોજના રહેશે. મૂળમાં તો જ્ઞાતિમાં સુસંપ કુદરતી ખીલશે.

- એક જ્ઞાતિજન, ઘાટકોપર

પ્રાણાયામ અને ધ્યાન ૧૪મા પાનાથી ચાલુ

ધ્યાન મગન મુદ્રાઓના યોગથી મગજ ઉચ્ચતમ ક્ષમતા પર કામ કરતું થાય છે. રિસર્ચ કરનારાઓએ એ વિદ્યાર્થીનીઓને માત્ર યોગ જ નહિ પણ અલગ અલગ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ પણ કરાવી હતી. તેમણે નોંધ્યું હતું કે ૨૦ મિનિટના જોગિંગ કે એરોબીક કસરત પછી યાદશક્તિ કે મગજની સર્તકતામાં લગભગ નહિવત ફાયદો થાય છે જ્યારે ઊંડા શ્વાસ સાથે કરવામાં આવેલ યોગાસનોથી સતર્કતામાં ઘણો વધારો થાય છે. પ્રાણાયામ યોગથી અસ્થામા જેવી બિમારી સંપૂર્ણ મટી શકે છે. આઘાત લાગ્યો હોય તો તે પણ યોગથી સાફ થાય છે. યોગ એ આપણી જુની વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં ફક્ત શારીરિક ક્રિયા કે મુદ્રાઓ નથી પણ શ્વાસોચ્છવાસ પર નિયંત્રણ અને ધ્યાન કેન્દ્રિત કરીએ ત્યારે નકામા વિચારો મગજમાંથી દૂર થાય છે. બ્રીસ્ક વોક કે જોગિંગ કે અમુક કસરતોમાં શરીરની અંદરના અવયવને કસરત નથી મળતી જે યોગ કરવાથી મળે છે. ઘર અને ઘરની અંદરની દરેક વસ્તુઓની જેમ શરીરને સાફ કરવાની અને મન, મગજને સાફ કરવાની જરૂર છે જે યોગથી થાય છે.



૧૫મી પુણ્યતિથી
પિતાશ્રી

શ્રી ધ્યાં જ લી
તેરા (કચ્છ)



૧લી પુણ્યતિથી
માતુશ્રી

વિશનજી ધનજી ખોના
દેહવિલય (તિથી: મા.સુ. ૨)
તા. ૨૭.૧૧.૨૦૦૦

ગંગાબાઇ વિશનજી ખોના
દેહવિલય (તિથી: કા.વ.૩૦)
તા. ૨૧.૧૧.૨૦૧૪

જેમ ચંદન જાતે ઘસાઇને અન્યને સુગંધ બક્ષે તેમ આપ બાળપણથી અંત સુધી તનતોડ મહેનત કરી અમોને સુખનો સાગર સોંપતા ગયા. આપનો નિ:સ્વાર્થ સ્વભાવ, નીડરતા, પ્રમાણિકતા અને વ્યવહારિક કોઠાસુઝનો વારસો અમારા માટે હંમેશા માર્ગદર્શક બની રહેશે. આપના અધૂરા સ્વપ્નોને પૂર્ણ કરવા ઇશ્વર અમને શક્તિ આપે અને આપના પવિત્ર આત્માને શાશ્વત શાંતિ બક્ષે એવી પ્રાર્થના...

શ્રી ધ્યાંજલી સુમન

માતુશ્રી વાલબાઇ ધનજી શીવજી ખોના સુખપરીયા પરિવાર
માતુશ્રી ભચીબાઇ ખીમજી ભારમલ મૈશરી-મોટી સિંધોડી પરિવાર
જલ્પા-પંકજ | પ્રવિણા-પ્રતાપ | કિશોરી-હંસકુમાર
તેજલ, અંકુશ, રોહન, આકાશ લાલકા તેમજ સમસ્ત પરિવાર

REQUIRED

Accounts Assistance at
Masjid Bunder Office
knowledge of Tally is a must.
Send Bio-data to e-mail ID -
devdharamsey@gmail.com
or
Contact Mobile No. :
093216 68511

શુભેચ્છાઓ સહ...

સાંધવ રત્ન

શ્રી મુલજી રાઘવજી લોડાયા

MRL Group of Companies



જ્ઞાતિના સ્પર્શતા સમાચારો ટૂંકમાં પાનાની
એક બાજુએ સારા અક્ષરે કાર્યક્રમ પૂર્ણ
થાય કે તરત લખી મોકલવા વિનંતી.

કચ્છી જૈન મહિલા મંડળ

સંઘ તરફથી તા.૧૫.૧૧.૧૫ ના રોજ સ્નેહમિલન રાખવામાં આવેલ. પાસ થયેલ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ, જે છોકરાઓ પાસ થયેલ તેમના ફોટો અને રીઝલ્ટ સ્ક્રીન ઉપર બધા જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તે સાથે બાળકો માટે ગીત પણ રાખવામાં આવેલ આ માટે ચિરલ બુરીયા, ડીમ્પલ લાલકા, રાહુલ શાહ, યશ શાહ એ જહેમત ઉઠાવી હતી.

મહિલા મંડળ તરફથી તા.૨૧.૧૧.૧૫ ના રોજ સ્નેહમિલન રાખવામાં આવેલ, હાઉઝી રમાડેલ. ઉમર પ્રમાણે સજી-તૈયારી થઈ ને આવનારને પ્રાઈઝ આપવામાં આવેલ જજ તરીકે વર્ષા વિરેશ લુઠિયા પધારેલ. ૨૫ થી ૪૦માં નીરા સમીર લાલકા, ૪૧ થી ૫૫ માં જસ્મીન સાવલા, ૫૫ થી ઉપરમાં મીરાબેન મોતાને પ્રાઈઝ મળેલ.

વર્ષાબેન તરફથી મંડળને ૧૧૦૦ રૂ. ભેટ મળેલ છે. ખાલી બેગમાં દિવાળીમાં વપરાતી વસ્તુની ચીઠ્ઠી બનાવી. ટીંગાડેલ પછી તેને તોડીને ચીઠ્ઠી ઉપરથી મીઠાઈમાં પૂજા લાલકા, ફરસાણામાંમાં મંજરી વીરા, દીવાળીની વસ્તુમાં ધનલક્ષ્મી દોલતને પ્રાઈઝ મળેલ. લક્કી ડ્રોમાં ૧) રીટા બેન ૨) વર્ષા લુઠિયા ૩) મીરાબેન મોતા ૪) પ્રભાબેન ધુલ્લા ૫) મંજુલાબેન ૬) રક્ષાબેન ૭) કેતન શાહ ૮) દીપાલી મોતા ૯) લીલાવંતીબેન માડ ૧૦) ધનલક્ષ્મી ધુલ્લાને પ્રાઈઝ મળેલ. અલ્પાહાર જયશ્રીબેન ખોના તરફથી રાખવામાં આવેલ.

પારોલા સંઘ

ધરણગામમાં ચાર્તુમાસાર્થે બિરાજમાન પૂજ્ય સાધ્વીશ્રી કલ્પપૂર્ણાશ્રીજી મ.સા. આદિ ઠાણા ૩ ની નિશ્રામાં યોજાયેલ ૪૫ આગમ પૂજનમાં

પારોલાતીર્થથી પરમ પૂજ્ય પ્રવચન પ્રભાવક મુનિવર શ્રી દેવરત્ન સાગરજી મ.સા.ના પ્રેરણાથી સંચાલિત શ્રી શાંતિ જિન ગુણ જૈન પાઠશાળા બાલકો, પારોલા મહિલા મંડળ તેમજ ટ્રસ્ટીગણે સારી સંખ્યામાં ભાગ લીધેલ. પૂજ્ય સાધ્વીશ્રીજી ભગવંતોને વંદન કરી મંગલિક સાંભળીને સાંજના પારોલા તરફ પ્રયાણ કરેલ. સંઘપતિનો લાભ સ્વ. અ.સૌ.કલ્પનાબેન ગોવિંદજી સોનીના સ્મરણાર્થે હસ્તે નેણાસી શામજી સોની પરિવાર(સાંચરા) ધુલીયાવાલાએ લીધેલ.

કાતરક સુદ પૂનમના શ્રી શંત્રુજ્ય પદ્મ દર્શનમાં બહારગામથી, શ્રી પારોલા તીર્થમાં તેમજ ગામવાસીઓની સારી સંખ્યામાં હાજરી થઈ હતી. આરતીનો લાભ શેઠશ્રી શાંતિલાલ હરીલાલ ઘંઘુકીયા પરિવાર પારોલાએ તથા મંગલ દીવાનો લાભ શેઠશ્રી હરકીસનદાસ હરીલાલ ઘંઘુકીયા પરિવારે લીધેલ. શ્રી પારોલા નિવાસી જ્ઞાતિજનો તરફથી સ્વામીવાત્સલ્ય રાખવામાં આવેલ.

છત્તીસગઢ ક.દ.ઓ.જૈન સંઘ (મહાજન)ની

સામાન્ય સભા

છત્તીસગઢ ક.દ.ઓ. જ્ઞાતિ સંઘ (મહાજન)નું દીપાવલી મિલન અને સામાન્ય વાર્ષિક સભા તા.૧૫.૧૧.૨૦૧૫ રવિવારે યોજવામાં આવેલ. મહિલા મંડળ અને યુવા મંડળનો પણ ઉલ્લાસપૂર્વક સંપૂર્ણ સહયોગ મળેલ. વિશેષ અતિથિ હતા શ્રી દિનેશ ડુંગરશી મોમાયા અને શ્રીમતી ઉષાબેન દિનેશ મોમાયા.


અધ્યક્ષ શ્રી તરૂણ શિવજી લોડાયા અને મંચસ્થ અતિથિઓએ ભગવાન શ્રી કુશુંનાથ દાદા અને માં કાળી માંની સામે દીપ પ્રજ્વલિત કર્યુ અને ભાવ ભક્તિથી માલ્યાર્પણ કરી તેમજ સર્વેને દિવાળી અને



ABDASA (KACHCHH) GAUSHALA TRUST

(Trust Regn. No. E-2071-Kachchh P.A. No. AABTA 7039 A)

C/o. Vipul Shivji Damaji, Village Rapar Gadhwal, Taluka Abdasa (Nalia).
Dist. Kachchh, Gujarat State - 370 645 Tel. : (02831) (952831) 273256.



Mumbai Office : Mota Trading P. Ltd. 101, Manratna Business Park, 1st Floor, Junction of Derasar Lane, & Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077, Tel. : 022 4422 9100 /199 Fax : 022 4422 9119

નવા વર્ષની શુભ કામના આપી.

જ્ઞાતિ શિરોમણી શેઠ શ્રી નરશીનાથાની ફોટો ઉપર માલાર્પણ માતુશ્રી વિજયાબેન ઉત્તમચંદ લોડાયા પરિવારે કરેલ.

સમાજના ૬૦ ટકા થી ઉપર માર્ક મળેલા વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ મંચરૂથ અતિથિઓએ કરેલ.

વિતેલા વર્ષ દરમ્યાન જેટલા સદસ્યો અરિહંત શરણે થયા બધાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કાર્યક્રમનું સંચાલન સમાજના સચિવ શ્રી હિતેશ મોતીચંદ શિયાડ અને સહસચિવ શ્રી અમિત કુલિન જીવાણી એ કરેલ.

લોનાવલા નગરે માં આશાપુરા માંની પહેડી

જખૌ ગામના નીમવારા ફરીયામાં બીરાજમાન શ્રી આશાપુરા માને નમતા મૈશેરી પરિવારની પહેડી પ્રસાદનું આયોજન તા ૧૫.૧૧.૧૫ને રવિવાર કારતક સુદ ચોથના દિવસે શ્રી સાધનાબેન રમેશ મૈશેરી પરિવારના લોનાવલામાં બંગલે થયું હતું. નિયાણી બહેનો સહિત મુંબઈ અને દેશાવરથી પધારેલા ૬૫ થી ૭૦ ભાવિકોની હાજરી હતી. શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપના કાર્યકરોએ પણ હાજરી આપી. શ્રી મહાકાળી ભાવનાં મંડળ ડૉબિવલીનાં ભાઈઓએ પધારી ભાવનાની રમઝટ બોલાવી.

બીજી પહેડી ૨૦૧૬ ની દિવાળી પછી કચ્છ જખૌ મધ્યે થશે જેનો લાભ શ્રી અશોક ગોવિંદજી મૈશેરી પરિવારે લીધેલ છે.

શ્રી ક.દ.ઓ.જૈન જ્ઞાતિ મહાજન-રવા

શ્રી ક.દ.ઓ.જૈન જ્ઞાતિ મહાજન રવા દ્વારા તા ૧૧.૧૦ના રવા ગામના જ્ઞાતિજનોનું સ્નેહમિલન શેઠશ્રી નરશીનાથા સભાગૃહ ભાડુંપમાં યોજાયેલ. જેમાં ગામના ઉત્સાહી જ્ઞાતિજનો અને ગામની નિયાણીઓ અને તેમના પરિવારજનો ૧૨૫ થી વધુ સંખ્યામાં હાજર રહેલ.

રવા ગામના પ્રમુખ શ્રી કીરીટ લક્ષ્મીચંદ

લાપસીયા તથા અતિથી વિશેષ શ્રી ક.દ.ઓ.મુંબઈ મહાજનના પ્રમુખ શ્રી કલ્પેશ મોતા, શ્રી અચલગચ્છ જૈન સંઘ પ્રમુખ શ્રી શામજી દંડ, શ્રી સમસ્ત મહાજનના માનદ મંત્રી શ્રી ચીમન મોતા, અને મુંબઈ મહાજનના ઉપપ્રમુખ શ્રી હિરાલાલ ડાઘા, શ્રી લેરીન ખોના અને માનદ મંત્રી શ્રી રમેશ લોડાયા આદિ ઉપસ્થિત હતા.

દીપ પ્રાગટ્ય, પૂજ્ય સાધ્વીશ્રી પુષ્પગુણા શ્રીજી મ.સા. આશીર્વાચન તથા માંગલિક સાંભળ્યા બાદ સામુહિક ક્ષમાપના, સાંસ્કૃતિક કાર્યક્રમ, તપસ્વીઓનું બહુમાન, ગામની ઉચ્ચ સિધ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ શ્રી જયંત લાપસીયા, (ઈન્ટરનેશનલ ક્રીકેટ કોમેન્ટેટર) શ્રી ઉદય લાપસીયા (ઈન્ટરનેશનલ ડી.જે), હેમલ લોડાયા (ગોલ્ડ મેડાલીસ્ટ ડાયટીશીયન), ખુશ્બુ લુઠિયા (મોટીવિશન) આદિનું બહુમાન કરવામાં આવેલ.

શ્રી કીરીટ લાપસીયા, શ્રી ગિરીશ ગોવિંદજી લોડાયા, શ્રી શરદભાઈ (સુરત), શ્રી સુરેન્દ્ર લોડાયાના માર્ગદર્શન અને શ્રી કલ્પેશ લોડાયા, શ્રી હિરેન લુઠિયા, શ્રી અનુજ લોડાયા તેમજ શ્રી હિતેન (રીજત) લોડાયાના મહેનત અને ગામવાસીઓના પ્રતિસાદની કાર્યક્રમ સફળ રહેલ. કાર્યક્રમનું સૂત્ર સંચાલન ચેતના હરીયા એન્ડ મ્યુજીકલ પાર્ટી દ્વારા કરવામાં આવેલ. આભાર પ્રદર્શન અનુજ લોડાયા એ કરેલ.

સાઈ હીલીંગ સેન્ટર વિવિધ પ્રકારના ધ્યાનથી શારીરીક-માનસિક-આધ્યાત્મિકમાં પ્રગતિ, (આભા મંડળ) ઓરા સેકેનીંગથી તમારી એનર્જીને જોઈ શકો છો. પાંચ તત્વના મહત્વ અને ફાયદા, રેકી, કઝણા રેકી, ડીએનએ, સાઈકીક સર્જરી જેવા વિવિધ કોર્સથી તમારા શારીરીક-માનસિક, અભ્યાસ, સંબંધ, પૈસા, કાર્યમાં થતા અટકાવાને કર્મિક બંધનથી મુક્તિ, ક્રિસ્ટલ અને ક્રિસ્ટલ હીલીંગથી થતા ફાયદા, વાસ્તુ દ્વારા તમને તમારા ઘર, ઓફીસ, પ્રોપર્ટીમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ મેળવો. દર સોમવારે ફ્રી સેમીનાર. ગ્રુપમાં પ્રોગ્રામ કરવા માટે સંપર્ક કરી શકો છો.
ડૉ. શિતલ શાહ અને ડૉ. સ્મિતા છેડા - 098331 37526



જ્ઞાતિના સર્વાંગીણ વિકાસ માટે સમર્પિત
શ્રી નરશી જેઠાભાઈ દંડ પરિવાર (વરાડીયા-મલકાપુર)

M/s. VIRCHAND NARSHI COTTON PVT. LTD.

Asia's First ISO 9001:2000 Certified Gin Press

નવા/બદલાવેલા સરનામા-(પુરું નામ અને નવું સરનામું થોકલવાની સાથે જુનું રદ કરવાનું સરનામું અવશ્ય જણાવવું)

મહેન્દ્ર સી. નાગડા	રૂમ નં. ૧૦૧, એકમ ભવન, હોટેલ ઈલારકની પાછળ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ-૩૭૦૦૦૧.
ચંપકલાલ દયાલાલ ખોના	રૂમ નં. ૨૦૯, શ્રી સંકલ્પ, મહાત્મા કુલે રોડ, મહારાષ્ટ્ર નગર, કંચન બગંલોની નજીક, ડોંબિવલી (પ) ૪૨૧ ૨૦૨
લહેરચંદ પદમશી સાયલા	K-1201, Parishkaar II, Phase II Opp: Khokhra Police Station, Opp. Rokadiya Hanuman Temple, Nr. Khokhra Circle, New Maninagar, Khokhra, Ahmedabad-380 008.
માણોકજી કાનજી મૈશેરી	રૂમ નં. ૧૨, ચાલ નં-૬, ગોવિંદ નગર, દત્ત મંદિર રોડની સામે, ચિલેજ રોડ, ભાડુંપ (પ), મુંબઈ-૪૦૦૦૭૮.
કીરીટ એમ. દંડ	ઈ-૧૧૦૧, સાઈ રેડીયન્સ, પ્લોટ નં. ૫૯-૬૧, સેક્ટર-૫, સીબીડી-બેલાપુર, નવી મુંબઈ-૪૦૦ ૬૧૪.
પ્રમેશ હંસરાજ દંડ સાંધવ	૬૦૨, હોરીઝોન પર્લ (સરથા સોસાયટી), ગણેશ ગાવડે કોસ રોડ, ઓલડ પ્રગતિ હોસ્પિટલ પાસે, મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૮૦. ફોન: 2590 0516, 093222 77220/074983 06062

જીવનચક્ર

સગપણ

૧૭.૧૧.૧૫	સેંધવા	અંકીત દીલીપભાઈ લક્ષ્મીચંદ નાગડા	ગોએરસમા	૨૭
	વડોદરા	રીના નરેન્દ્ર નરશી ગોસર	ગોએરસમા	૨૬
૨૨.૧૧.૧૫	પાચોરા	સંકેત કિરીટ ભવાનજી લોડાયા	વારાપધર	૨૫
	ભાડુંપ	નિરલ જવેરચંદ કેશવજી લોડાયા	બાયઠ	૨૩
આંતર જ્ઞાતિય સગપણ				
૨૦.૧૧.૧૫	હાલોલ	સંદીપ સુરેશ લાલચંદ લોડાયા	સાંધવ	૨૯
	પૂના	શિતલ એસ.બી	પૂના	૧૯
૨૨.૧૧.૧૫	એમ્બુર	ભરત જયેશ વેલજી ગાલા	કાંડાગરા	૨૮
	કોચીન	ચાંદની રાજેન્દ્ર મુલચંદ મોમાયા	વરાડીયા	૨૮
૨૨.૧૧.૧૫	મુલુંડ	વિક્રમ ઉત્તમ રામનાથ ગીતે	સંગમનેર	૨૪
	મુલુંડ	પૂજા જયેશ નવીનચંદ્ર ખોના	વાંકુ	૨૪
૨૬.૧૧.૧૫	ચોટીલા	દર્શન નવીનચંદ કાંતિલાલ શાહ	ચોટીલા	૨૮
	ઘાટકોપર	કૃપા ચંદ્રકાંત પદમશી નાગડા	નલીયા	૨૧

મરણ


૨૧.૧૧.૧૫	ગાંધીધામ	લબ્ધિકુમાર ભવાનજી મોમાયા	જખો	૬૩
૨૨.૧૧.૧૫	ઘાટકોપર	નલીનકાંત રાયચંદ લોડાયા	વારપધર	૭૬
૨૨.૧૧.૧૫	મુંદ્રા	કસ્તુરીબેન ગોવિંદજી ધુલ્લા	બાંઢિયા	૭૮
૨૩.૧૧.૧૫	સાલેમ	મણિલાલ ત્રિકમજી સોની	વાંકુ	૮૫
૨૪.૧૧.૧૫	વિરાર	જવેરચંદ લાલજી લોડાયા	કુવાપધર	૭૫
૨૬.૧૧.૧૫	બડગરા	પ્રેમજી દેવરાજ લોડાયા	વારાપધર	૯૩
૨૭.૧૧.૧૫	કલ્યાણ	કુંવરજી મેઘજી મોતા	નલિયા	૮૫
૨૮.૧૧.૧૫	નવી મુંબઈ (વાશી)	સોમચંદ જેઠાભાઈ ડાઘા	-	૮૧

સાર્થક ચાતુર્માસ માટે નિશ્રા આપનારા ગુરુ ભગવંતોના ઠાણા ઉઠાણા નિમિત્તે ભાવિકો ભાવવિભોર

મસ્જિદ બંદર ક.દ.ઓ. જૈન સંઘ



ભાંડુપ ક.દ.ઓ. જૈન સંઘ



મુલુંડ અચલગચ્છ જૈન સંઘ



દેવલાલી અચલગચ્છ જૈન સંઘ



કાર્તિકી પુર્ણિમા નિમિત્તે પારોલામાં શૈત્રુંજય મહાતીર્થ પટદર્શન કાર્યક્રમ



સુથરી જે મેઘાશા કે મિલ્યા વા ભગવાન...!!

- અબુદ્દ ભક્તે કેય પણા, પ્રભુ કઈયેંતા સહાય,
 મેઘાશાજી ગાલ સુણી, મનમેં હરખ ન માય, (૧)
 મેઘાશા મથે બોજ ઘણા, સ્થિતિ સાવ કંગાળ;
 આપઘાતજો વિચાર કેં, વડી હૂઈ જંજાળ, (૨)
 દેવવાણી થઈ ખમ, મર - મ - ભરખમ;
 સપને મેં ડિસી દેવ, જાગ્યા પુણ્ય કરમ. (૩)
 વાણી ઈ થૈજે માનીયેંજો પોટલો, મડેઈ વહાણ વટે ખણી વિન;
 ને ઈ પોટલોડે બ્યો પોટલો ગિની, તું ઘરે પાછો અચી વિન. (૪)
 મોંઘી માનીજો સાટો કંઈઘે, મિલ્યો પોટલો જેમેં વા ભગવાન;
 પોટલે કે ગોખલેમેં રખી છડે, સચ્યે મૂલ્યથી અજાણ. (૫)
 ખોટાંઈઘે ન ખોટે માની, એળો થ્યો ચમત્કાર;
 અબુદ્દ ભક્ત જે ઘર મિંજા, દૂર થ્યો અંધકાર. (૬)
 જ પોટલો ખોલે ન્યાર્યા, ત મીંજાથી નિકર્યા ભગવાન;
 ગામવારા ભેગા થૈને નેક્કી ક્યાં, દેરેમેં પઘરાઈબો ભગવાન. (૭)
 વિક્રમ સંવત ૧૮૯૫મેં, ઉગઘે સોનેરી પ્રભાત;
 ઘૃતકલ્લોલ વિક્રા ગાદી તેં, ખુલ્યો ગામજો ભાગ. (૮)
 ગામ જમાડ્યાં પ્રેમથી, પ્રભુ તે રખી આધાર;
 ઘી જે કૂપમેં વેઈ, અખૂટ ક્યાં ઘીજી ધાર. (૯)
 ઘૃતમેં કલ્લોલ કરી, પ્રગટ્યા પારસનાથ;
 ઘૃતકલ્લોલ ચોવાણા, સદા ભાવિકેં જે સાથ. (૧૦)
 ચડતી થઈ ગામજી, વરત્યો જય જયકાર;
 સોનથરી સુખથી ભરી, ચોપાસ ઉમંગ અપાર. (૧૧)
 કચ્છમેં સોનજી લંકાસમ, આય સોનથરી ગામ;
 સજ્જન દાનેશ્વરીયેં ફેલાંયાં, ચૌ દિશ જેજો નામ. (૧૨)
 ઘૃત કલ્લોલજો મહિમા જિજજો, દેશ અને પરદેશ;
 સુથરી ગામજી ઉન્નતિ થઈ, ગામજા પલટ્યા વેશ. (૧૩)
 અબડાસેજે પંચ તીર્થીએમે, સુથરી મહા તીરથ ધામ;
 સાંધાણ - કોઠારા - જખૌ ને નલિયા - તેરા ગામ. (૧૪)
 - રશ્મિન્ ખોના - મુંબઈ

-: સૌજન્ય :-

માતુશ્રી કુંવરબાઈ વિસનજી માયાં મોતા
 (કચ્છ - સુથરી)

પ્રતિભાવંત જ્ઞાતિકિશોર હાર્દિક સમીર લાલકા અને સાથી ગ્રામીણ આઈ.ટી. ક્વીઝમાં તૃતીય સ્થાને



સોનગઢ રત્નાશ્રમમાં ભણતા હાર્દિક સમીર લાલકા અને હીત સંજય મહેતાની ટીમે કર્નાટક સરકારના બી.ટી. ડીપાર્ટમેન્ટ દ્વારા આયોજીત અને ટી.સી.એસ. દ્વારા સ્પોન્સર થયેલ રૂરલ આઈ.ટી. ક્વીઝ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધીત્વ કરતા તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

શ્રી શાંતિજિન ગ્રુપ દ્વારા ખેલકૂદ પર્વ

રજત જયંતી નિમિતે શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ - મુંબઈએ રવિવાર, તા. ૨૨/૧૧/૧૫ના ખેલકૂદ પર્વની ઉજવણી જિમખાના, ડોંબિવલીમાં કરી હતી. શાંતિજિન સ્ટ્રાઈકર્સ, પટેલ ફાઈટર્સ, એક્કિઝમ ઈક્સલ, એચવી કિંગ, મહાવીર વોરિયર્સ, મહાકાલી બ્લાસ્ટર્સ, નેપ્ચ્યુન ચેઝર્સ, ફોરચ્યુન સ્ટાર એમ આઠ ટીમે વચ્ચેની ક્રિકેટ સ્પર્ધામાં નેપ્ચ્યુન ચેઝર્સ વિજેતા અને મહાવીર વોરિયર્સ દ્વિતીય ક્રમે રહી હતી. વિજેતા ટીમ, રનરઅપ ટીમ અને સારો દેખાવ કરનારા ખિલાડીઓને ઈનામો અપાયા હતા.



if undelivered, please return to :
C.D.O. PRAKASH SAMIKSHA, C/o. R. R. Nagda, Advocate, 29/41, Tamarind Lane, Rajabahadur Compund, Near Stock Exchange Bldg., Fort, Mumbai - 400 001.
 Printed & Published by : **RAICHAND R. NAGDA** on behalf of **C.D.O. PRAKASH SAMIKSHA, SAMITI (Owner)** and Printed at **THE NEW MILLENNIUM PRINTERS**, 314, Mathuradas Mill Compound, N. M. Joshi Marg, Lower Parel, Mumbai - 400013 and Published by him from Premises No. 13A Situate at 29/41, Tamarind Lane, Rajabahadur Compund, Fort, Mumbai - 400 001. **Editor : Raichand R. Nagda**

To,